

# તરકીબે નમાઝ

અહમિયત, તરકીબ ઓર મસાઈલ

• મુરત્તિબ •

મૌલાના હબીબુર્હમાન શોખ

• સાલિક અમીરે હલ્કા, ગુજરાત •

## કોણરિસ્ટ

### ૧. નમાઝ

- નમાઝ
- નમાઝકી અહિમિયત
- નમાઝકે ફાયદે
- નમાઝસે કુવ્વત
- હકીકી નમાઝ
- નમાઝ કિન પર ફરજ હૈ ?

### ૨. પાકીકા બયાન

- ગુસ્લકા બયાન
- વુગ્ગૂકા બયાન
- તથભુમકા બયાન

### ૩. તરકીબે નમાઝ

- અળાનકા બયાન
- નમાઝકા બયાન
- નમાઝકી શર્તે
- નમાઝકે અરકાન

- વાજિબાતે નમાઝ
- નમાઝકી સુન્નતે
- મુફસિદાતે નમાઝ
- મકરહાતે નમાઝ
- નમાઝકે અવકાત
- નમાઝ પઢનેકા તરીકા-તરકીબ  
સજૂદાએ સંદૂધકા બયાન  
વિત્રકી નમાઝ
- નમાજે તરાવીહ  
બીમારકી નમાઝ
- મુસાફિરકી નમાઝ
- જુમાકી નમાઝ
- ઇદેનકી નમાઝ
- જનાર્જેકી નમાઝ

### ૪. મસ્તૂન દુઆઓ

## પેશ લખ્યું

નમાજ દીનકા સબસે અહમ ઔર બુનિયાદી સુતૂન હૈ. નમાજ મર્ટે મો'મિનકો બુરાઈયોંસે બચાતી હૈ ઔર નેકિયોં પર ચલનેવાલા બનાતી હૈ. નમાજ મો'મિનકો અલ્લાહકા મુખલિસ ઔર મહબૂબ બંદા બનાતી હૈ. નમાજ હી સે મુશ્કિલાતમેં સબ્ર વ ઈસ્તિકામત હાસિલ હોતે હોં ઔર યહ હકીકત કિતાબ વ સુન્નતસે વાઝેહ હૈ.

યહ એક હકીકત હૈ કે જો નમાજે હમ પઢતે હોં ઉનસે હમ કમ ફાયદે હાસિલ કરતે હોં, જિસકા નતીજા યહ હૈ કે હમ સીરત વ કિરદાર કે ઈસ્લામી મે'યાર પર પૂરે ઉત્તરનેમંના નાકામ રહતે હોં. હમ આજમાઈશોં ઔર મુશ્કિલાતમેં સાબિત કદમીકા સુભૂત નહીં દે પાતે, નમાજકો હમારી લિંગગીમેં વહ મુકામ-જગહ- હાસિલ નહીં હોતા જો મુકામ મો'મિનકી લિંગગીમેં નમાજકા હોના ચાહિયે.

ઉઘતે મુસ્લિમા (ચંદ અફરાદકો છોડ કર) ઈકામતે સલાતસે ગફલત બરત રહી હૈ જિસકા નતીજા યહ નિકલ રહા હૈ કે ઈસ્લામકા નિઝામે તરબિયત દરહમ-બરહમ.(બિખરના) હો કર રહ ગયા હૈ ! એક અરસેસે ઈસ બાતકી જરૂરત મહસૂસ કી જા રહી થી કે દીને ઈસ્લામમંને નમાજકો જો મુકામ હાસિલ હૈ ઉસ્કી અહમિયત મુસલમાનોનો બતાતે, ઈસ કીમતી દૌલતકો આમ કરતે ઔર ઈસ પર અમલ કરનેકે લિયે એક ઐસી કિતાબ આસાન ઉર્દૂ જબાન ઔર ગુજરાતી હર્ફોમં લિખી જાતી જિસકે ઝરીએ નમાજકે બારેમે ઝરૂરી મા'લૂમાત એક હી જગહ ઔર એક હી કિતાબમે હાસિલ હો જાયે. હમ ઈસ બાત પર ખુદાકા શુક અદા કરતે હોં કે ઈસ કમીકો પૂરા કરનેકી સઆદત હમેં નસીબ હુદ્દી હૈ.

---

ਈਸ ਕਿਤਾਬ ਮੈਂ ਦੀਨ ਮੈਂ ਨ ਮਾਝ ਕੀ ਅਹਮਿਤ, ਉਸ ਕਾ ਮੁਕਾਮ ਔਰ ਉਸ ਕੀ ਅੜ੍ਹਰਤ ਪਰ ਰੋਸ਼ਨੀ ਢਾਲਨੇ ਕੇ ਸਾਥ ਛੀ ਸਾਥ ਨ ਮਾਝ ਕੇ ਜੜ੍ਹਰੀ ਮਸਾਈਲ ਪਰ ਆਸਾਨ ਜਭਾਨ ਮੈਂ ਰੋਸ਼ਨੀ ਢਾਲੀ ਗਈ ਹੈ. ਔਰ ਆਖਿਰ ਮੈਂ ਜੜ੍ਹਰੀ ਮਸ਼ਨੂਜ਼ ਹੁਆਂ ਭੀ ਰਾਮਿਲ ਕਰ ਦੀ ਗਈ ਹੈਂ. ਈਸ ਕਿਤਾਬ ਸੇ ਕਮ ਪਛੇ-ਲਿਖੇ ਅਵਾਮ, ਤਲਬਾ, ਤਾਲਿਬਾਤ, ਦੀਨ ਕਾ ਕਾਮ ਕਰਨੇ ਵਾਲੇ, ਮਫਸੋਸ਼ ਮੈਂ ਪਛਾਨੇ ਵਾਲੇ ਅਚਾਤਿਆਂ ਔਰ ਅਈਮਾਂ ਮਸਾਜਿਦ ਸਥ ਛੀ ਫਾਯਦਾ ਉਠਾ ਸਕਤੇ ਹੈਂ. ਈਸ ਕਿਤਾਬ ਕੀ ਮੁਰਤਬ ਕਰਨੇ ਮੈਂ ਮੁਹੱਮਦ ਉਬੈਦੁਲਲਾਹ ਖਾਂ ਜੁਹਾਨੇ ਕਾਝੀ ਤਾਵੁਨ ਕਿਧਾ ਹੈ ਈਸ ਕੇ ਲਿਖੇ ਹਮ ਉਨ ਕੇ ਮਸ਼ਕੂਰ ਹੈਂ.

ਅਲਲਾਹ ਤਾਵਲਾਸੇ ਹੁਆ ਹੈ ਕੇ ਵਹ ਹਮਾਰੀ ਈਸ ਕੀ ਸ਼ਿਖਿਕੀ ਕਿਭੂਲਿਧਤ ਕਾ ਦਰਜਾ ਅਤਾ ਫਰਮਾਏ ਔਰ ਆਮ ਮੁਸਲਮਾਨਾਂ ਕੀ ਈਸ ਸੇ ਈਸਤੇਫਾਦੇ (ਫਾਯਦਾ ਉਠਾਨੇ) ਕੀ ਤੌਫ਼ਿਕ ਅਤਾ ਫਰਮਾਏ ਔਰ ਹਮਾਰੀ ਕੋਤਾਹਿਯੋਂ ਕੀ ਮੁਅਕਾਸ਼ ਫਰਮਾਏ, ਆਮੀਨ. (ਮੇ, ੧੯੮੩)

ਤਾਲਿਬੇ ਹੁਆ,

ਛਡੀਬੁਰੰਘਮਾਨ ਸ਼੍ਰੀਅ

---

# ૧. નમાજ

- નમાજ

- નમાજકી અહમિયત

- નમાજકે ફાયદે

- નમાજસે કુવ્યત

- હકીકી નમાજ

- નમાજ કિન પર ફરજ હૈ ?

## નમાજ :

ઈસ્લામને જો ઈબાદતે હમ પર ફર્જ કી હું ઉનમેં નમાજ સબસે જ્યાદા અહમ હૈ, યહ એક ઐસી ઈબાદત હૈ જો કિસી હાલતમેં છોડી નહીં જ સકતી. ઈન્સાનકી પૂરી જિંદગીકો અલ્લાહકી ઈબાદત બનાનેમેં નમાજ સબસે જ્યાદા અસર ડાલનેવાલી હૈ. નમાજ ઈન્સાનમેં યે સલાહિયત ઔર તાકત પેદા કરતી હૈ કે વહ હર વકત યહ બાત યાદ રખે કે વહ અલ્લાહકા બંદા હૈ. ઉસે અપની યહ હૈસિયત હર વકત યાદ રહે કે મેં અલ્લાહકા પેદાઈશી ગુલામ હું ઔર ઉસને મુજે અપની બંદગીકે લિયે પેદા કિયા હૈ ઔર ઈસલિયે મેરે લિયે જરૂરી હૈ કે મેરી સારી જિંદગી અલ્લાહકી ઈબાદતમેં ગુજરે. કભી એક પલકે લિયે ભી મેં ઉસકી ઈબાદતસે ગાફિલ ન રહું.

ઈસ જિલચિલેમેં સબસે પેહલી બાત તો યહ હૈ કે આપ કિસી ભી વકત ઈસ બાતકો ન ભૂલેં કે આપ ખુદાકે બંદે હું ઔર એક પલકે લિયે ભી યહ બાત આપકે દિમાગસે ઓળખ ન હોને પાએ કે આપકો હર હાલમેં ઉસીકી મરજીકે મુતાબિક જિંદગી ગુજારની હૈ.

ઈન્સાનકે સાથ ઉસકા નફ્સ લગા હુવા હૈ. ઉસકે અંદર કઈ કિસ્મકી જ્વાહિશાત રખ દી ગઈ હું ઔર શયતાન હર વકત ઈસ ઘાતમેં લગા રહતા હૈ કે કબ ઉસકા દાવ ચલે ઔર વહ ઈન્સાનકો અલ્લાહકી બંદગીકે રાસ્તેસે હટા હે. ઈસ લિયે ઈસ બાતકી સખ્ત જરૂરત હૈ કે ઈન્સાનકો દિનમેં કઈ બાર યહ યાદ દિલાયા જાય કે તૂ ખુદાકા બંદા હૈ, તુજે ઉસીકી મરજી પર ચલના હૈ.

યહી કામ નમાજ કરતી હૈ, સુખણ ઉઠતે હી સબસે પેહલે વહ યહી બાત યાદ દિલાતી હૈ. ઈસ તરહ ચંદ ધંટોકે બાદ ફિર યહી સબક પઢાયા જાતા હૈ, ઔર થોડે થોડે વકતકે બાદ રાત હોને તક તીન બાર ઈસી બાતકી યાદ દિલાઈ જાતી હૈ. નમાજ આપકે અંદર જિભેદારીકા એહસાસ

પેદા કરતી હૈ, નમાજ આપકો ફર્જ-શનાસ બનાતી હૈ, વહ આપમે યહ આદત પેદા કરતી હૈ કે આપ અપને ફર્જ કો પેહચાને ઔર ઉસે પૂરા કરનેકે લિયે પૂરી દિલચ્છીકે સાથ તૈયાર રહે.

નમાજ દિનમાં પાંચ વકત આપને વકત પર આપકો અલ્લાહકે દરબારમે હાજરીકે લિયે પુકારતી હૈ. અગર આપ ઈસ પુકારકો સુન કર ફૌરન ઉઠ ખડે હોં, હર કામકો છોડ કર નમાજકી તરફ લપર્કે, તો ઈસસે યહ મા'લૂમ હો જાએગા કે આપ અલ્લાહ તાલાકી ઈતાઅત ઔર ફરમાંબરદારીકે લિયે પૂરી તરફ તૈયાર હોં ઔર અપના ફર્જ પેહચાનતે હો.

નમાજ આપકે અંદર અલ્લાહકા ઉર પેદા કરતી હૈ. જબ તક મુસલમાનકે દિલમાં અલ્લાહકા ખૌફ ન હો ઉસ વકત તક વહ ઈસ્લામકે મુતાબિક જિંદગી નહીં ગુજાર સકતા. અલ્લાહકા ઉર મુસલમાનકો ખુલે ઔર છુપે હર હાલમાં અલ્લાહકી નાફરમાનીસે રોકતા હૈ. જબ તક મુસલમાનકો યહ યકીન ન હો કે અલ્લાહ ઉસે દેખ રહા હૈ ઔર ઉસકે દિલકે ખયાલોંકો ભી જાનતા હૈ ઉસ વકત તક વહ અલ્લાહકી નાફરમાનીસે નહીં બચ સકતા. અલ્લાહ પર યહી ઈમાન એક મુસલમાનકો હર વકત હલાલ ઔર હરામમાં તમીજ કરતા હૈ. રોજાના પાંચ વકતકી નમાજ મુસલમાનકે અંદર ઈસી યકીનકો પેદા કરતી હૈ. વહ જબ નમાજ પઢતા હૈ તો ઉસકો ઈસ બાતકા યકીન હોતા હૈ કે અલ્લાહ ઉસકો દેખ રહા હૈ.

નમાજ મુસલમાનકો ખુદાકી ઈતાઅત ઔર ફરમાંબરદારી પર કાયમ રખતી હૈ. મુસલમાનકે અંદર શુક ઔર ખુદાકી તા'રીફ ઔર ઉસકે ઈન્નામોંકા એહસાસ પેદા કરતી હૈ. નમાજ ઈન્સાનકે અંદર અલ્લાહસે મુહૂબ્બત ઔર ફરમાંબરદારીકે જાબાત પેદા કરતી હૈ. નમાજ શુક ઔર એહસાનમંદીકી મુકભ્મલ તસવીર હૈ. નમાજસે પેદા હોનેવાલી ઈન સિફાતકો સામને રખિયે ઔર ફિર ઈસ્લા કીજિયે કે અગર આપ વાકઈ યહ ચાહતે હોં કે દુનિયામાં અલ્લાહકે બંદ બન કર રહે ઔર આપકી પૂરી જિંદગી ઈભાતદત બન જાએ તો આપ નમાજકે બગેર યે ખૂબિયાં (સિફાત)

अपने अंदर कैसे पेदा कर सकते हैं ? नमाज इन्सानको अल्लाहकी फरमांबरदारीके रास्ते पर कायम रखती है।

## नमाजकी अहमियत :

इस्लामी ज़िंदगी गुजारनेके लिये और दीनके तकाऊओंको पूरा करनेके लिये आपको जिस ताकतकी झड़त है उसे हासिल करनेका जरीआ-साधन नमाज है। इमानके इकरारके बाद सबसे पेहली जिम्मेदारी जो एक मुसलमान पर आती है वह नमाजका कायम करना है। मुसलमान इस जिम्मेदारीसे किसी वक्त और किसी हालमें मुँह नहीं भोड़ सकता। इस्लाममें किसी दूसरे कामको वह अहमियत हासिल नहीं है जो नमाजको है। कुर्अनेपाकमें नमाजकी ताकीद और ज़िक्र जिस कसरतसे (बार बार) हुआ है उतना ज़िक्र किसी दूसरी इबादतका नहीं हुवा। यह भी आपने सुना होगा के क्यामतके दिन जब बढ़े अपने मालिकके सामने अपने हिसाब-किताबके लिये खड़े होंगे तब सबसे पेहले उनसे नमाजके बारेमें पूछ-परछ होगी। कुर्अनेपाकमें एक जगह अल्लाह अल्लाह तआलाने यह नकशा इस तरह पेश फरमाया है के जब ऐहले इमान क्यामतके दिन अल्लाहके बाणियोंको अज्ञाबमें मुब्तेला देखेंगे तो उनसे पूछेंगे के बताओ तो सही इस मुसीबतमें कैसे इंस गये और तुम्हारे वह आ'माल क्या थे जो तुम्हें दोजापमें ले आए। तो उस वक्त वह लोग जो ज्वाब देंगे उसमें हम सबके लिये इबरत व नसीहतका सामान भौजूद है। वह सबसे पेहले अपने जिस संगीन जुर्मका ज़िक्र करेंगे, वह नमाज न पढ़ना होगा, वह कहेंगे, 'हम नमाज नहीं पढ़ते थे, भोहताजोंको खाना नहीं भिलाते थे, कुजूल बातोंमें उलझे रहनेवालोंके साथ हम भी उलझे रहते थे, और क्यामतके दिनका इन्कार करते थे।' इससे अंदरां लगाईओं के नमाज न पढ़ना अल्लाहके यहां कितना बड़ा जुर्म शुमार होगा। असल बात यह है कि इस्लाममें नमाजको जो अहमियत हासिल है वह आजकल हमारे गेहनोंसे तकरीबन निकल चुकी है, दालांके इस्लामने नमाजको मुसलमान

और काफिर के दरभियान पेहचान करार दिया है। यही वजह है के क्यामतमें काफिरोंका अंजाम बयान करते हुए सबसे पेहले यह बात कही गई है के वह नमाज नहीं पढ़ते थे। नवीने करीम सल्लल्लाहु अलैहि वसल्लमने नमाजको ईमान और कुफ्फे दरभ्यान फँक करनेवाली चीज़ फरमाया है। हज़रत ज़ाबिर रदियल्लाहु तआला अन्हु फरमाते हैं के मैंने रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लमको ईशां फरमाते सुना है के, ‘ईन बयन-२-रजुलि व बयन-श-शिरूकि वल कुँकि तरकस्सलात’ (सहीह मुस्लिम - ८२)। या’नी नमाज छोड़ देने के बाद एक शप्स जिस मुकाम तक पहोंच जाता है उसमें और कुफ़ व शिक्क मुकाममें कोई फँक नहीं रह जाता और इस तरह नमाज छोड़ देनेवाला अमलन काफिरों जैसा हो जाता है। हज़रत बुरैदा रदियल्लाहु तआला अन्हुने फरमाया है के नवी सल्लल्लाहु अलैहि वसल्लमने ईशां फरमाया के: बयनना व बयनहुमुस्सलाता ईमन तरक्खा फँक डक्करा (ज़ाबेअ तिर्मिजी- २६२१) (या’नी हमारे और काफिरोंके दरभ्यान फँक करनेवाली चीज़ नमाज है, तो जिसने नमाज छोड़ दी उसने कुँका तरीका ईजियार किया।)

नवी सल्लल्लाहु अलैहि वसल्लमके जमानेमें मुसलमान यह सोच भी नहीं सकते थे के वह नमाज न पढ़ें यहां तक के जो लोग दिलसे ईमान नहीं लाते थे और किसी दबाव, लालच या किसी और गरजसे यूँ ही दिखानेके लिये मुसलमान बन गए थे वह भी पांचों वक्त नमाजके लिये मस्जिदमें आते थे। फँक यह था के “और जब ये नमाजके लिये उठते हैं तो कस-मसाते हुए महज लोगोंको दिखानेकी खातिर उठते हैं और खुदाको कम ही याद करते हैं.” (सूरः निसा - १४२)

हज़रत ईब्ने मसूदी रदि। फरमाते हैं के एक भरतवा मैंने नवी सल्लल्लाहु अलैहि वसल्लमसे पूछा के नेक आ’मालमें सबसे ऊचा दरज़ किस अमलका है। तो हुग्गूर सल्लल्लाहु अलैहि वसल्लमने ईशां फरमाया के वक्त पर नमाज पढ़ना। ईसके बाद हिर कीनसा अमल है ? तो

ફરમાયા: મા-બાપકે સાથ અસ્થા સુલૂક. કિર ઉન્હોને પૂછા કે અસ્થા ઈસકે બાદ કિસ અમલકા દરજા હૈ, તો ઈશ્વર્દિ ફરમાયા કે, અલ્લાહીની રાહમેં ઉસકે દીનકો ગાલિબ કરનેકે લિયે જાન તોડ કોશિશ કરના. (મિશ્કાત, અલ મસાબીહ, હદ્દીસ - ૫૬૮)

ઔર કિર યહ સુનિયે કે નભી સલ્લાહુ અલૈહિ વસ્તુમને અપની ઉમ્મતકે લિયે વસીયતકે તૌર પર એક આખરી દિદાર્યત ભી છોડી હૈ.

રિવાયતમાં આતા હૈ કે ઈસ જહાને ફાનીસે રૂખસત હોતે હુએ નભીએ કરીમ સલ્લાહુ અલૈહિ વસ્તુમકી જબાન પર જો આખરી અદ્ગાહ થે વહ યે થે:

“અસ્સલાતુસ્સલાતુ વ મા મલકત અયમાનુકુમુલ્લાહ.” યાની ‘નમાજ ઔર તુમ્હારે લોડી - ગુલામ.’ (સહીહુલ જામેઅ - ૩૮૭૩)

સુની આપને અપને ઘારે રસૂલ સલ્લાહુ અલૈહિ વસ્તુમકી આખરી વસીયત ? ઈસ વસીયતકી મૌજૂદગીમાં ઈસ બાતકી કયા ગુંજાઈશ હૈ કે કોઈ શાખ નમાજ ન પઢતે હુએ અપને આપકો રસૂલુલ્લાહ સલ્લાહુ અલૈહિ વસ્તુમકી ઉમ્મતમેં શુમાર કરે, યા નભીએ કરીમ સલ્લાહુ અલૈહિ વસ્તુમસે મુહષ્બતકા દમ ભરે, હુઝૂર સલ્લાહુ અલૈહિ વસ્તુમકે નામ પર સીરત ઔર મીલાદકે જલ્સે કરે. સોચના ચાહિયે કે ઐસે લોગ કયામત કે દિન ઘારે રસૂલુલ્લાહ સલ્લાહુ અલૈહિ વસ્તુમકી કયા મુંહ દિખાએંગે.

### નમાજકે ફાયદે :

અલ્લાહ તથાલાને ઈશ્વર્દિ ફરમાયા કે ઈન્નસલાત તન્દા અનિલ ફહશાઈ વલ મુન્કર (સૂર: અન્કબૂત - ૪૫) (બેશક નમાજ ગંદે ઔર બુરે કામોંસે રોકતી હૈ). નમાજકે બહોતસે ફાયદોમાંસે એક બડા અહમ ફાયદા

ਧਣ ਹੈ ਕੇ ਨਮਾਜ਼ ਦੀ ਵਹ ਜ਼ਰੀਆ ਹੈ ਜਿਸसੇ ਈਨਸਾਨ ਬੁਰਾਈਂਓਂਦੇ ਬਚ ਸਕਤਾ ਹੈ। ਅੱਖਲਾਕੀ ਬੁਰਾਈਂਓਂਦੇ ਪਾਕ ਹੋਨਾ ਧੂ ਭੀ ਈਨਸਾਨਕੇ ਲਿਖੇ ਬਛੋਤ ਜ਼ਿਥੀ ਬਾਤ ਹੈ, ਔਰ ਕੌਨ ਐਸਾ ਹੋਗਾ ਜੋ ਈਸਕੀ ਘਵਾਹਿਸ਼ ਨ ਕਰੇ। ਕਿਧੋਂ ਕੇ ਧਣੀ ਤੋ ਏਕ ਚੀਜ਼ ਹੈ ਜੋ ਈਨਸਾਨਕੇ ਫੁਨਿਆ ਔਰ ਆਖਿਰਤ ਫੋਨੋਂ ਜਗਹ ਫਾਖਦਾ ਪਛਾਂਦਾ ਹੈ। ਲੇਕਿਨ ਈਸਕਾ ਏਕ ਔਰ ਜ਼ਬਰਦਸਤ ਫਾਖਦਾ ਭੀ ਹੈ ਔਰ ਵਹ ਧਣ ਕੇ ਅਗਰ ਵਾਕਈ ਕੁਛ ਲੋਗਾਂਕੇ ਅੱਖਲਾਕ ਪਾਕੀਆ ਹੋ ਜਾਂਦੇ ਔਰ ਉਨਕੇ ਕਿਰਦਾਰ ਬੁਰਾਈਂਓਂਦੇ ਪਾਕ ਹੋ ਜਾਂਦੇ ਤੋ ਐਸੇ ਲੋਗਾਂ ਪਰ ਜ਼ਬਰਦਸਤ ਬਰਤਰੀ ਅਤ੍ਸਿਲ ਹੋ ਜਾਂਦੀ ਹੈ ਜੇ ਤਰਫ-ਤਰਫ਼ੀ ਅੱਖਲਾਕੀ ਬੁਰਾਈਂਓਂਮੈਂ ਮੁਖਲਾ ਹੋਂ। ਦੀਨਕੀ ਸਰਭੁਲਾਂਦੀਕੀ ਰਾਹਿਂ ਧਣੀ ਅੱਖਲਾਕੀ ਬਰਤਰੀਕਾ ਵੀ ਪੇਹਲਾ ਜੀਨਾ (ਸੀਫੀ) ਹੈ ਜਿਸ ਪਰ ਚਢਨਾ ਏਹਲੇ ਹਕਕੇ ਲਿਖੇ ਜ਼ਰੂਰੀ ਹੈ। ਔਰ ਈਸਕੇ ਬਹੁੰ ਦੀਨਕੀ ਸਰਭੁਲਾਂਦ ਕਰਨੇਕੀ ਕੋਣਿਸ਼ਿਆਂਕੀ ਇਅਜਿਦਾ ਹੀ ਨਹੀਂ ਹੋਤੀ।

ਅਸਲ ਬਾਤ ਧਣ ਹੈ ਕੇ ਜ਼ਿਹਾਂ ਤਕ ਬੁਰਾਈਂਓਂਦੇ ਰੋਕਨੇਕਾ ਤਾ'ਲੂਕ ਹੈ ਤੋ ਨਮਾਜ਼ ਲਾਕਿਮਨ ਧਣ ਕਾਮ ਕਰਤੀ ਹੈ। ਆਪ ਅਗਰ ਨਨਮਾਜ਼ਕੀ ਨੋਈਧਤ ਪਰ ਜ਼ਰਾ ਸਾ ਭੀ ਗੈਰ ਕੱਝੋਂ ਤੋ ਧਣ ਤਸਵੀਮ ਕਰ ਲੇਂਗੇ ਤੇ ਈਨਸਾਨਕੇ ਬੁਰਾਈਂਓਂਦੇ ਰੋਕਨੇਕੇ ਲਿਖੇ ਜਿਤਨੇ ਮੁਅਸ਼ਿਸ਼-ਅਸਰਦਾਰ ਤਰੀਕੇ ਮੁਮਕਿਨ ਹੋਂ ਉਨਮੈਂ ਸਭਦੇ ਜਧਾਦਾ ਕਾਰਗਰ ਔਰ ਮੁਅਸ਼ਿਸ਼ਰ ਜ਼ਰੀਆ ਨਮਾਜ਼ ਦੀ ਹੋ ਸਕਤਾ ਹੈ। ਭਲਾ ਸੋਚਿਥੇ ਤੋ ਸਹੀ ਕੇ ਜ਼ਬ ਆਦਮੀਕੀ ਹੁਰ ਰੋਜ਼ ਪਾਂਥ-ਪਾਂਥ ਬਾਰ ਖੁਦਾਕੀ ਧਾਇਕੇ ਲਿਖੇ ਬੁਲਾਯਾ ਜਾਂਦੇ ਔਰ ਉਸਕੇ ਜ਼ਿਹਨਮੈਂ ਧਣ ਬਾਤ ਤਾਜ਼ਾ ਕੀ ਜਾਂਦੀ ਕੇ ਤੂ ਈਸ ਫੁਨਿਆਮੈਂ ਖੁਦਮੁਖਤਾਰ ਔਰ ਆਖਾਦ ਨਹੀਂ ਹੈ ਬਲਕੇ ਤੂ ਖੁਦਾਕਾ ਬੰਦਾ ਹੈ ਔਰ ਤੂਜੇ ਉਸਕੀ ਬੰਦਗੀਕਾ ਈਕਰਾਰ ਕਿਯਾ ਹੈ ਔਰ ਤੇਰਾ ਖੁਦਾ ਵਹ ਹੈ ਜੋ ਤੇਰੇ ਖੁਲੇ ਔਰ ਛੁਪੇ ਹਰ ਕਾਮਕੇ ਫੇਖ ਰਹਾ ਹੈ। ਧ਼ਿਹਾਂ ਤਕ ਕੇ ਵਹ ਤੇਰੇ ਫਿਲਕੇ ਹਿਰਾਂਦਾਂ ਔਰ ਨੀਘਤ ਤਕਕੀ ਜਾਨਤਾ ਹੈ। ਔਰ ਫੇਖ ਏਕ ਐਸਾ ਵਕਤ ਆਨੇਵਾਲਾ ਹੈ ਜ਼ਬ ਤੁਝੇ ਉਸ ਖੁਦਾਕੇ ਸਾਮਨੇ ਹਾਜ਼ਿਰ ਹੋਨਾ ਪਹੇਗਾ। ਔਰ ਅਪਨੇ ਏਕ-ਏਕ ਕਾਮਕੀ ਜਵਾਬਦੇਹੀ ਕਰਨਾ ਹੋਗੀ। ਤੋ ਫਿਰ ਧਣ ਤੇਸੇ ਹੋ ਸਕਤਾ ਹੈ ਕੇ ਐਸਾ ਸ਼ਾਖਸ ਜਾਨ-ਬੂੜ ਕਰ ਗਲਤ ਰਾਹਿਂ ਪਰ ਚਲੇ। ਧੂ ਗਲਤੀ ਕਿਸਸੇ ਨਹੀਂ ਹੋ ਜਾਂਦੀ, ਲੇਕਿਨ ਗਲਤੀ ਹੋ ਜਾਨਾ ਔਰ ਬਾਤ ਹੈ ਔਰ ਗਲਤੀ ਕਰਤੇ ਰੇਹਨਾ।

ਦੂਸਰੀ ਬਾਤ ਹੈ। ਫਿਰ ਨਮਾਜਕਾ ਕਾਮ ਇਤਨਾ ਹੀ ਤੋ ਨਹੀਂ ਕੇ ਵਹ ਇਨ ਭਾਤੋਂਕੇ ਸਿੱਖ ਧਾਇਆਤੀ ਹੋ, ਬਲਕੇ ਨਮਾਜ਼ਮੰਨੇ ਹਰ ਸ਼ਾਬਿਦੀ ਮਥਕ-ਪ੍ਰੋਜ਼ੈਕਟਸ) ਜੀ ਕਰਾਈ ਜਾਤੀ ਹੈ ਕੇ ਵਹ ਛੁਪਕਰ ਭੀ ਅਪਨੇ ਖੁਦਾਕੇ ਕਿਸੀ ਹੁਕਮਕੀ ਪਿਲਾਫਵਰਾਈ ਨ ਕਰੇ। ਨਮਾਜਕੇ ਲਿਧੇ ਉਠਨੇਕੇ ਵਕਤਸੇ ਲੋਕਰ ਨਮਾਜ ਘਰਮੁਕ ਕਰਨੇ ਤਕ ਹਰ ਆਦਮੀਕੀ ਲਗਾਤਾਰ ਐਸੇ ਕਾਮ ਕਰਨੇ ਪੜਤੇ ਹੋਣ ਜਿਨ੍ਹਾਂ ਉਥਕੇ ਔਰ ਖੁਦਾਕੇ ਸਿਵਾ ਕੋਈ ਤੀਸਰੀ ਹਸਤੀ ਯੇ ਜਾਨਨੇਵਾਲੀ ਨਹੀਂ ਹੋਤੀ ਕੇ ਉਸ ਸ਼ਾਬਿਦੀ ਖੁਦਾਕੇ ਕਾਨੂੰਨਕੀ ਪਾਬੰਦੀ ਕੀ ਹੈ ਧਾ ਉਥੇ ਤੋਡ ਦਿਧਾ ਹੈ।

ਅਥ ਰਹਾ ਯੇ ਸਚਾਲ ਕੇ ਆਦਮੀ ਨਮਾਜ ਭੀ ਪਥਤਾ ਰੇਹਤਾ ਹੈ ਔਰ ਅਮਲਨ ਬੁਰਾਈਓਂਕੇ ਰੁਕਤਾ ਭੀ ਨਹੀਂ। ਤੋ ਦਰਅਸਲ ਬੁਰਾਈਓਂਕੇ ਬਚਨੇਕਾ ਇਨਿਸਾਰ (ਆਧਾਰ) ਖੁਦ ਉਸ ਆਦਮੀ ਪਰ ਹੈ ਜੋ ਖੁਦ ਨਮਾਜ ਪਥਤਾ ਹੈ। ਪੇਹਲੀ ਬਾਤ ਧਹ ਕੇ ਨਮਾਜਕੇ ਫਾਖਦਾ ਉਠਾਨੇਕੇ ਲਿਧੇ ਜ਼ਰੂਰੀ ਹੈ ਕੇ ਆਦਮੀ ਪੇਹਲੇ ਧਹ ਇਕਾਈ ਤੋ ਕਰੇ ਕੇ ਮੁੜੇ ਬੁਰਾਈਓਂਕੇ ਬਚਨਾ ਹੈ। ਜਬ ਤਕ ਇਨਸਾਨ ਖੁਦ ਨਮਾਜਕੇ ਫਾਖਦਾ ਉਠਾਨੇਕੀ ਨੀਂਘਤ ਨਹੀਂ ਕਰੇਗਾ। ਉਸ ਵਕਤ ਤਕ ਉਸ ਪਰ ਨਮਾਜਕੇ ਵਹ ਅਸਰਾਤ ਨਹੀਂ ਪੱਧੇਗੇ ਜਿਨ੍ਹਾਂ ਤਰ੍ਹਾਂ ਅਲਵਾਹਕੇ ਇਕਾਈਓਂ ਇਕਾਈਆਂ ਕਿਧਾ ਗਿਆ ਹੈ।

### ਨਮਾਜਕੇ ਕੁਝਤ :

ਨਮਾਜਕੀ ਜੋ ਅਹਮਿਤ ਦੀਨਮੰਨੇ ਹੈ ਔਰ ਜਿਸਕੀ ਤਫ਼ਸੀਲਾਤ ਉਪਰ ਬਧਾਨ ਹੁੰਦੀ ਹੈ ਇਸਕਾ ਸਹੀ ਅਂਦਾਜਾ ਉਸ ਵਕਤ ਹੋਤਾ ਹੈ ਜਬ ਆਪ ਧਹ ਮੇਹਸੂਸ ਕਰ ਸਕੇਂ ਕੇ ਅਲਵਾਹ ਤਾਤਾਵਾਨੇ ਤਿਸ ਤਰਫ ਨਮਾਜਕੋ ਮੌਮਿਨਕੇ ਲਿਧੇ ਕੁਝਤਕਾ ਏਕ ਬਢਾ ਖੜਾਨਾ ਬਨਾਧਾ ਹੈ। ਅਗਰ ਬਾਤ ਸਿੱਖ ਇਤਨੀ ਹੋਤੀ ਕੇ ਕੁਛ ਲੋਗ ਦੂਜਾਂਕੀ ਪੂਜਾਪਾਠ ਛੋਡਕਰ ਅਲਵਾਹਕੀ ਪਰਸਿਤਿਸ਼ੁ ਕਰਨੇ ਲਗੇਂ। ਔਰ ਤਨਾਹਾਈਓਂਮੰਨੇ ਬੇਠਕਰ ਅਲਵਾਹਕੀ ਧਾਇਆ ਕਰਤੇ ਰਹੇਂ ਤੋ ਧਹ ਮੁਆਮਲਾ ਕੁਛ ਜਧਾਦਾ ਮੁਸ਼ਕਿਲ ਨ ਥਾ। ਇਸ ਤਰਫ ਅਲਵਾਹਕੀ ਪੂਜ ਲੇਨੇਕੀ ਇਤਨੀ ਜਾਗਰਤ ਬਲਕੇ ਸਹੂਲਤ ਤੋ ਹਰ ਕਾਫ਼ਿਰਾਨਾ ਨਿਯਮਮੰਨੇ ਮਿਲ ਹੀ ਜਾਤੀ ਹੈ। ਲੇਕਿਨ ਆਪ ਜਾਨ ਚੁਕੇ ਹੋਣੇ ਕੇ ਇਸਲਾਮ ਇਸ ਤਰਫਕਾ ਕੋਈ ਮਜ਼ਹਬ ਨਹੀਂ ਹੈ ਜੋ ਇਨਸਾਨਕੀ ਮਹਿਜ ਇਨਿਸ਼ਾਨੀ-

વ्यक्तिगत लिंगीसे मुताबिल्क हो बल्कि ईस्लामकी खुसूसियत ही थह है के वह पूरी लिंगीको अपने दायरेमें लेता है. बस यही एक कठिन बात है; ईसीकी वजहसे कशमकश शुरू होती है और मो'मिनको नित-नई मुश्किलातका सामना करना पड़ता है. क्यों के वक्तेका छाया हुआ निजाम ईन्सानी लिंगीके बड़े हिस्सेको अपनी मरणी और घ्वाहिशके मुताबिक चलाना चाहता है. और वह इसे पसंद नहीं करता के ईन्सानी लिंगीके आम मुआम्लातमें उसकी मरणीके जिलाफ़ किसी औरकी मरणी चले, युनांचे वह हर उस आवाजको दबा देना चाहता है जिसकी ज़दू उसके ईक्तिदार-सत्ता पर पड़े. अब अगर मो'मिन ईस फ़ैसले पर कायम रेहना चाहता है के उसकी पूरी लिंगी अल्लाहकी ईताअतमें बसर हो तो उसे वक्त की ईन कुव्वतोंसे टक्कर लेना पड़ती है और अब मो'मिनको उससे मुकाबलेके लिये ताकत और कुव्वतकी झटकरत होती है.

कुर्अनेपाकके मुतालआसे साफ़-साफ़ ये मालूम होता है के आं हज़रत सल्लल्लाहु अलैहि वसल्लम और आपके साथियोंको जब भी मुश्किल हालात दरपेश आये तो ताकीद नमाज कायम करनेकी ही की गई. सूरः अनूक्षुत जिस जमानेमें नाजिल हुई है वह वक्त मुसलमानोंके लिये बहोत सज्ज था. दीन पर कायम रेहना उनके लिये निहायत मुश्किल काम हो गया था. खानदानवाले अलग दबाव देते और सोसायटी-समाजके लोग अलग सताते थे. गरज यह के तरह तरहकी लालच दी जाती थी. और तरह तरहसे सताया जाता था. अगर आप ईस सूरः का मुतालआ करेंगे तो पेहले ही रुक्कओंमें उन मुश्किलातका नकशा आपके सामने आ जायेगा. उस जमानेमें ऐहले ईमान पर जो लुभ व स्तितम तोड़ जा रहे थे उनके होते मुसलमानोंका ईमान पर कायम रेहना बहोत मुश्किल काम हो गया था. उस भौके पर अल्लाह तआलाने कुव्वत हासिल करनेके लिये जो प्रेक्टिकल तदबीर बताई वह यही है के (हे नबी ! तिलावत करो उस किताबकी जो तुम्हारी तरफ वहा (वही) के जरीए भेज गई है, और नमाज कायम करो.) कुर्अनेपाककी तिलावत और नमाजका

કાયમ કરના હી વહ દો ચીજેં હૈં જો એક મો'મિનમે વહ તાકત પૈદા કરતી હૈં જિસકે બલ પર વો બાતિલકે બકેસે બકે તૂફાનોંકે મુકાબલેમેં ખડા રેહ સકતા હૈ. બલ્કે તૂફાનકા રૂખ મોડ સકતા હૈ. યહ બાત આપ સમજતે હી હૈ કે તેલાવતે કુર્ચાનીપાક ઔર નમાજસે વહ તાકત ઉસી વકત હાસિલ હો સકતી હૈ જબ કે કુર્ચાનીકે મહા અલ્ફાઝ જબાનસે અદા કર લેનેકો કાફી ન સમજેં બલ્કે વહ કુર્ચાનીકી તા'લીમાતકો ઠીક-ઠીક સમજકર ઉસકે બતાયે હુએ સાંચોમેં અપની ક્રિંગીકો ઢાલતે ચલે જાએં. ઔર ઈસી તરહ નમાજ બદનકી કુછ હરકત ઔર જબાનસે કુછ અલ્ફાઝ અદા કર લેનેકા નામ ન હો બલ્કે નમાજ ઉસકે અભલાક વ કિરદારકો નથે સાંચોમેં ઢાલ દે ઔર નમાજ ઉસકે અંદર હરકત ઔર અમલકે લિયે એક નઈ કુચ્ચત પૈદા કર દે.

ઈસી તરહ સૂર: બનીઈસ્માઈલ જિસ જમાનમે નાજિલ હુઈ વહ મક્કી ક્રિંગીકા આખરી દૌર થા. મુસલમાનોં પર મુસીબતોંકે પહાડ તોડે જા રહે થે ઔર દુશ્મનોંને વહ તથ કર લિયા થા કે જિસ તરહ ભી હો આં હજરત સલ્લાહ્વાહુ અલૈહિ વસ્લલમકો કટલ કર દિયા જાએ ઔર ઈસ તરહ ઈસ ઉભરતી હુઈ તાકતકો હમેશાકે લિયે દબા દિયા જાએ. ચુનાંચે ઈસી સૂર: મેં અલ્વાહ તઆલાને એક જગહ ફરમાયા હૈ કે 'વહ લોગ ઈસ બાત પર તુલે હૈં કે તુમ્હારે કદમ ઈસ સરજમીનસે ઉખાડ દે ઔર તુમ્હેં યહાંસે નિકાલ દે.' (સૂર: બનીઈસ્માઈલ - ૭૬) ઈન સખ્ત ઢાલાતમેં અલ્વાહ તઆલાને યહી હિદાયત દી કે 'નમાજ કાયમ કરો, સૂરજકે ઢલનેસે લેકર રાતકે અંધેરે તક ઔર સુષ્ણકા કુર્ચાન પઢના જરૂરી ઠેહરા લો ઔર ઈસકે ફીરન બાદ તહજૃદકી નમાજકી તરફ મુતવજજા કિયા ગયા હૈ. ઈસસે સાફ મા'લૂમ હોતા હૈ કે મુશ્કિલ ઢાલાતમેં નમાજ કાયમ કરનેસે હી મો'મિનકો કુચ્ચત હાસિલ હો સકતી હૈ. વહ દો નમૂને તો મિસાલકે તૌર પર પેશ કિયે હૈં, વરના કુર્ચાનમેં હર જગહ આપ દેખેંગે કે આફિતોં ઔર મુશ્કિલોમેં નમાજસે કુચ્ચત હાસિલ કરનેકી તલ્કીન બાર-બાર કી ગઈ હૈ. હકીકત વહ હૈ કે મો'મિનકે લિયે નમાજ કુચ્ચતક ખજાના

ਹੈ ਔਰ ਮੁਖਿਕਲਾਤਕੇ ਛੁਜੂਮਿਂ ਹਕਕ ਪਰ ਜਮੇ ਰਹੇਨੇਕੇ ਲਿਧੇ ਧਣੀ ਏਕ ਕਾਰਗਰ ਤਥਾਂਬੀਰ ਹੈ। ਅਲਭਤਾ ਧਣ ਅਥਵੀ ਤਰਫ ਸਮਝ ਲੇਨਾ ਚਾਹਿਧੇ ਕੇ ਚਾਹੇ ਨਮਾਯਾਂਸੇ ਮਿਲਨੇਵਾਲੇ ਫਾਧਦੇ ਹੋਂ ਯਾ ਉਸਦੇ ਹਾਸਿਲ ਹੋਨੇਵਾਲੀ ਕੁਵਾਤ, ਇਨਮੌਂਸੇ ਹਰ ਸ਼ਾਬਦਕੇ ਉਤਨਾ ਹੀ ਹਿੱਸਾ ਮਿਲਤਾ ਹੈ ਜਿਤਨਾ ਉਸਦੀ ਨਮਾਯਾ, ਹਕੀਕੀ ਨਮਾਯਾ ਹੋਤੀ ਹੈ।

## ਹਕੀਕੀ ਨਮਾਯ :

ਹਕੀਕੀ ਨਮਾਯ ਤਿਥੇ ਕਹਤੇ ਹੋਂ ਧਣ ਬਾਤ ਸਮਝ ਲੇਨਾ ਚਾਹਿਧੇ, ਕੁਅੰਨੇਪਾਕਮੌਂ ਜਿਤਨੀ ਜਗਹ ਨਮਾਯਕਾ ਜਿਕ ਹੁਆ ਹੈ ਵਹਾਂ ਅਲਵਾਹਤਾਵਾਲਾਨੇ ਨਮਾਯ ਕਾਧਮ ਕਰਨੇਕਾ ਹੁਕਮ ਦਿਧਾ ਹੈ। ਨਮਾਯ ਪਫਨੇਕਾ ਲਫੜ੍ਹ ਕੁਅੰਨਮੌਂ ਤਿਸੀ ਜਗਹ ਨਹੀਂ ਆਧਾ ਹੈ। ਨਮਾਯ ਕਾਧਮ ਕਰਨੇਕੇ ਲਿਧੇ ਦੀਜੇ ਜ਼ਰੂਰੀ ਹੈ: ਏਕ ਨਮਾਯਕੀ ਆਹਿਰੀ ਸ਼ਕਲ ਔਰ ਦੂਸਰੀ ਨਮਾਯ ਪਫਨੇਵਾਲੇਕੀ ਦਿਲੀ ਕੈਫਿਧਤ, ਆਹਿਰੀ ਸ਼ਕਲਮੌਂ ਜੋ ਬਾਤੇ ਸ਼ਾਮਿਲ ਹੋਂ ਵਹ ਕੁਛ ਈਸ ਤਰਫ ਹੋ ਜੈਸੇ, ਨਮਾਯ ਵਕਤ ਪਰ ਪਫੀ ਜਾਧ, ਰੁਖ ਤਿਬਲੇਕੀ ਤਰਫ ਹੋ, ਨਮਾਯਿਕੇ ਕਪਤ ਔਰ ਨਮਾਯ ਪਫਨੇਕੀ ਜਗਹ ਪਾਕ ਹੋ, ਪੁਗੂ ਕਰ ਲਿਧਾ ਗਿਆ ਹੋ, ਜਥ ਆਦਮੀ ਨਮਾਯ ਪਫਨੇ ਖਡਾ ਹੋ ਜਾਏ ਤੋ ਈਧਰ-ਉਧਰ ਨ ਦੇਖੇ, ਨਾਨ੍ਹੋਂ ਸਜਟੇਕੀ ਜਗਹ ਪਰ ਰਖੇ, ਰੁਕੂਅ ਔਰ ਸੁਜੂਦ ਇਤਭੀਨਾਨਕੇ ਸਾਥ ਔਰ ਉਸ ਤਰੀਕੇ ਪਰ ਕਰੇ ਜੋ ਸ਼ਰੀਅਤਨੇ ਮੁਕਰੰਦ ਕਰ ਦਿਧਾ ਹੈ। ਔਰ ਨਮਾਯਮੌਂ ਕੋਈ ਐਸੀ ਹਰਕਤ ਨ ਕਰੇ ਜਿਦੇਕੇ ਕਰਨੇਕੀ ਮੁ'ਮਾਨਿਅਤ (ਮਨਾ) ਹੈ, ਔਰ ਮਦਦੀਕੇ ਲਿਧੇ ਜ਼ਰੂਰੀ ਹੈ ਕੇ ਵਹ ਨਮਾਯ ਜਮਾਅਤਕੇ ਸਾਥ ਮਾਲਿਅਦਮੌਂ ਅਦਾ ਕਰੇ।

ਦੂਸਰੀ ਚੀਜ਼ ਜੋ ਨਮਾਯ ਕਾਧਮ ਕਰਨੇਕੇ ਲਿਧੇ ਜ਼ਰੂਰੀ ਹੈ ਵਹ ਇਨਸਾਨਕੀ ਦਿਲੀ ਕੈਫਿਧਤ ਹੈ। ਆਦਮੀਕੀ ਪੂਰੀ ਕੋਣਿਆ ਧਣ ਹੋਨੀ ਚਾਹਿਧੇ ਕੇ ਨਮਾਯਕੇ ਵਕਤ ਉਸਕਾ ਦਿਲ ਪ੍ਰਦਾਕੀ ਤਰਫ ਮੁਤਵਜ਼ਾ ਹੋ ਔਰ ਜੋ ਕੁਛ ਵਹ ਜ਼ਬਾਨਸੇ ਕੇਹ ਰਹਾ ਹੋ ਵਹੀ ਦਿਲਸੇ ਭੀ ਅੰਝ ਕਰੇ। ਦਿਲਕੀ ਈਸ ਕੈਫਿਧਤਕੀ ਨਮਾਯ ਖੁਸ਼ੂਅ ਹੈ। ਖੁਸ਼ੂਅਕੇ ਅਸਲ ਮਾ'ਨੀ ਹੋਂ 'ਤਿਸੀਕੇ ਆਗੇ ਜੁਕ ਜਨਾ, ਦਬ ਜਨਾ, ਆਜਿੰਜੀ ਔਰ ਇਨਕਿਸਾਰੀਕਾ ਈਝਹਾਰ ਕਰਨਾ।' ਈਸ ਕੈਫਿਧਤਕਾ

તा'લુક દિલસે હૈ. ઈસકા મતલબ યહ હૈ કે નમાજ પઢનેવાલેકા દિલ અલ્લાહતઆલાકી હૈબત ઔર અજમત વ જલાલસે મરઉંબ હો. ઈસ કેફિયતકો પૈદા કરનેકે લિયે કોણિશ કરની પડતી હૈ ઔર નમાજકે ઉન તમામ જાહેરી (જો નજર આતે હો) આદાબકા લિહાજ કરના પડતા હૈ જિનકા જિક ઉપર હુવા હૈ. કોણિશ કરના ચાહિયે કે આદમી જાન-બૂજુકર નમાજમેં જૌર મુતા'લિક બાતે ન સોચે ઔર બિલા ઈરાદા જો ખ્યાલાત દિલમેં આંદોં ઉંછે પૂરી કોણિશકે સાથ દિલસે દૂર કિયે જાંઓ.

## નમાજ કિન પર ફરજ હૈ ?

હર આકિલ-વ-બાલિગ મુસલમાન પર નમાજ ફરજ હૈ. હિન્દુત આયશા સિદ્ધીકા રદ્દ. ફરમાતી હોં કે રસૂલુલ્લાહ સલ્લાલ્હ અદૈહિ વસલ્લમને ફરમાયા: તીન આદમીસે બાળપુર્સ નહીં. એક, સોયા હુવા આદમી યહાં તક કે વહ બેદાર હો જાએ. દૂસરા, બચ્ચા યહાં તક કે વહ બાલિગ હો જાયે. તીસરા, પાગલ યહાં તકકે વો બાહોશ હો જાએ. (અહમદ, અબુ દાઉદ, તિર્મિજી, નસાઈ, ઈબ્ને માજહ, હાકિમ)

બચ્ચે પર નમાજ ફરજ નહીં હૈ, લેકિના વાલિદૈનકો ચાહિયે કે જબ વો સાત સાલ કા હો જાએ તો ઉસે નમાજકા હુકમ હૈ. જબ દસ સાલકા હો જાએ તો મારેં ઔર દૂસરે મુઅસ્સિર તરીકે અપનાંઓ. નબી સલ્લાલ્હ અદૈહિ વસલ્લમને ફરમાયા હૈ કે 'તુમ્હારે બચ્ચે સાત સાલ કે હો જાએ તો ઉંછે નમાજકા હુકમ હો ઔર જબ દસ સાલ કે હો જાએ તો ઉંછે મારો ઔર ઉંકે સોનેકી જગહ અલગ કર દો. (મુસ્નદ અહમદ - ૧૦૮૪, અબુ દાઉદ, હાકિમ)

---

## ૨. પાકીકા બયાન

- ગુસ્લાકા બયાન
- વુજૂકા બયાન
- તયમુમકા બયાન

અલ્લાહતઆલાકે નેક બંદે વહ હું જો ખૂબ પાક-સાફ રહતે હું. પાકી ઔર સફાઈકો તહારત કહતે હું. રસૂલુલ્લાહ સલ્લાલ્લાહુ અદૈહિ વસ્ત્વમને ફરમાયા હૈ કે ‘પાકી આધા ઈમાન હૈ. (સહીહ મુસ્લિમ - ૫૭૪) દૂસરી જગહ રસૂલુલ્લાહ સલ્લાલ્લાહુ અદૈહિ વસ્ત્વમની ઈર્શાદ હૈ કે ‘જન્તકી કુંજી નમાજ હૈ’ ઔર નમાજકી કુંજી પાકી ઔર સફાઈ હૈ. (મિશ્કાત અલ મસાબીહ - ૫૫૫).

મુસ્તલમાન હર તરહકી નાપાકીસે દૂર રહતા હૈ. વહ અપને ઝાહિરકો ભી પાક રખતા હૈ ઔર બાતિનકો ભી. ઝાહિરકી પાકી તો વહ હૈ કે વહ અપના જિસમ, અપને કપડે, રહનેકી જગહ ઔર હર ચીજકો પાક-સાફ રખ્યે. બાતિનકી પાકી વહ હૈ કે વહ કુઝ વ શિર્કકી બાતોંસે અપને દિલકો પાક રખતા હૈ, બુરે ઘ્યાલાત દિલમંને નહીં લાતા, જૂટ, ગીબત ઔર બેશરમીકી બાતોંસે બચતા હૈ. દિલમંને દુશ્મની ઔર કીના નહીં રખતા, ઘમુંડ નહીં કરતા. અલ્લાહકો એક માનતા હૈ. હજરત મુહમ્મદ સલ્લાલ્લાહુ અદૈહિ વસ્ત્વમની લાઈ હુઈ શરીઅત પર પૂરા પૂરા અમલ કરતા હૈ. અલ્લાહકે બંદોંકે સાથ મુહબ્બત કરતા હૈ, ગર્જ ઉસકા જિસમ ભી ઔર ઉસકા દિલ ભી હર કિસ્મકી નાપાકીસે પાક રહતા હૈ.

નાપાકીકો નજસત ભી કેહતે હું. નજસત દો તરહ કી હોતી હૈ: નજસતે હુકમી ઔર નજસતે હકીકી.

### નજસતે હુકમી :

વહ નાપાકી જો દેખનેમંને નહીં આતી બલ્કે હજરત મુહમ્મદ સલ્લાલ્લાહુ અદૈહિ વસ્ત્વમને બતાનેસે માલૂમ હુઈ હૈ જેસે કોઈ શાખ બેવુગૂ હો તો વુગૂ કિયે બગૈર નમાજ નહીં પઢ સકતા. શરીઅતકી નજરમંને ઉસે પાકી હાસ્તિલ નહીં હૈ. પેશાબ-પાખાના કરના, રિયાહ ખારિજ હોના, ખૂન યા પીપકા બદનસે નિકલના, ટેક લગાકર સો જાના, મુંહ ભર કર કૈ (ઉલ્ટી)

ਹੋ ਜਾਨਾ, ਯੇ ਸਥ ਸੂਰਤੋਂ ਨਾਜ਼ਸਤੇ- ਛੁਕਮੀਕੀ ਹੈਂ। ਨਾਜ਼ਸਤੇ ਛੁਕਮੀ ਵੁਝੂ ਕਰਨੇਂਦੇ ਫੂਰ੍ਹ ਹੋ ਜਾਂਦੀ ਹੈਂ।

### ਨਾਜ਼ਸਤੇ ਛੁਕੀਕੀ :

ਵੋ ਨਾਪਾਕੀ ਜੋ ਆਂਖੋਂ ਦੇ ਵੱਖੀ ਜਾ ਸਕਤੀ ਹੈਂ ਔਰ ਜਿਸਦੇ ਇਨਸਾਨਕੇ ਕੁਦਰਤੀ ਤੌਰ ਪਰ ਵਿਨ ਆਤੀ ਹੈ ਔਰ ਅਪਨੇ ਆਪਕੇ ਉਸਦੇ ਬਚਾਤਾ ਹੈ। ਇਹ ਦੋ ਤਿੰਦੇ ਹਨ: (੧) ਨਾਜ਼ਸਤੇ ਗਲੀਆ (੨) ਨਾਜ਼ਸਤੇ ਖੜੀਕਾ।

### ਨਾਜ਼ਸਤੇ ਗਲੀਆ :

ਨਾਜ਼ਸਤੇ ਗਲੀਆ ਧਾਨੀ ਸਖਤ ਨਾਪਾਕੀ। ਇਹ ਦੋ ਛੁਕਮ ਭੀ ਸਖਤ ਹੈ ਜੈਂਦੇ ਇਨਸਾਨਾਂ ਦੀ ਪੇਸ਼ਾਬ-ਪਾਖਾਨਾ, ਇਨਸਾਨਾਂ ਔਰ ਜਾਨਵਰਾਂ ਦੀ ਖੂਨ, ਘੋੜੇ-ਗਧੇਕੀ ਲੀਇ, ਕੁਤੇ-ਬਿਲ੍ਲੀਕੀ ਪਾਖਾਨਾ, ਸ਼ਰਾਬ ਵਗੈਰਾਹ। ਸੁਵਿਵਰਕੀ ਤੋਂ ਹੁਣ ਚੀਜ਼ ਨਾਜ਼ਸਤੇ ਗਲੀਆ ਹੈ। ਅਗਰ ਧਾਨੀ ਕੁਝੇ ਕਪਦੇ, ਬਦਨ, ਟੇਬਲ, ਕੁਸ਼ਾ, ਪਲਾਂਗ ਔਰ ਖਾਟ ਪਰ ਲਗ ਜਾਂਦੇ ਤੋਂ ਤੀਨ ਬਾਰ ਧੋਨਾ ਜ਼ਰੂਰੀ ਹੈ, ਖਾਸ ਤੌਰ ਪਰ ਜਿਸ ਜਗ਼ਾ ਨਾਜ਼ਸਤ ਲਗੀ ਹੋ ਤੋਂ ਉਸਦੇ ਇਹ ਤਰਾਹ ਰਗਡ-ਰਗਡ ਕਰ ਧੋਨਾ ਚਾਹਿੇ ਕੇ ਦਾਗ-ਧਬਾ ਨ ਰਹੇ।

### ਨਾਜ਼ਸਤੇ ਖੜੀਕਾ :

ਨਾਜ਼ਸਤੇ ਖੜੀਕਾ ਧਾਨੀ ਵਹ ਨਾਪਾਕੀ ਜੋ ਨਾਜ਼ਸਤੇ ਗਲੀਆਦੇ ਜ਼ਰਾ ਹਲਕੀ ਹੋ, ਇਹ ਦੋ ਛੁਕਮ ਭੀ ਨਹੀਂ ਹੈ। ਹਲਾਲ ਜਾਨਵਰਾਂ ਦੀ ਪੇਸ਼ਾਬ, ਹਰਾਮ ਪਰਿਵਾਰਾਂ ਦੀ ਬਿਟ ਵਗੈਰਾਹ ਅਗਰ ਧਾਨੀ ਬਦਨ ਵਗੈਰਾਹ ਪਰ ਧਾਨੀ ਕਪਦੇ ਪਰ ਲਗ ਜਾਂਦੇ ਔਰ ਚੋਥੇ ਇਹਦੇ ਦੇ ਕਮ ਪਰ ਲਗੇ ਤੋਂ ਨਮਾਯ ਹੋ ਜਾਏਗੀ ਲੇਕਿਨ ਮਕੜੂਹ ਹੋਗੀ। ਇਹ ਲਿਧੇ ਬੇਹਤਰ ਧਾਨੀ ਹੈ ਕੇ ਨਾਜ਼ਸਤੇ ਖੜੀਕਾਕੇ ਮੁਆਮਲੇਮੇ ਐਹਤਿਧਾਰ ਰਖਨਾ ਚਾਹਿੇ ਔਰ ਜ਼ਹਾਂ ਤਕ ਹੋ ਸਕੇ ਅਪਨੇ ਬਦਨ ਔਰ ਕਪਦਾਂ ਦੀ ਨਾਜ਼ਸਤੇ ਖੜੀਕਾਦੇ ਭੀ ਪਾਕ ਔਰ ਸਾਫ਼ ਰਖੋ।

## ઇસ્તિંજા :

પાખાના ઔર પેશાબકે બાદ પાકી હાસિલ કરનેકો ઇસ્તિંજા કહતે હું. પેશાબ યા પાખાનેસે ફારિગ હો કર પેહલે ઢેલે ઈસ્તેમાલ કરને ચાહિયે ઔર ફિર પાનીસે ધો ડાલના ચાહિયે. અગર મિણીકે ઢેલે ન મિલેં તો ઈટકે ટુકડોંકો ઈસ્તેમાલ કિયા જા સકતા હૈ. હડી, કોયલા, ગોબર, કાગળ ઔર ખાનેકી ચીજોંસે ઇસ્તિંજા નહીં કરના ચાહિયે. ઇસ્તિંજા બાયેં (ડાબા) હાથસે કરના ચાહિયે.

## ગુસ્લકા બચાવન :

ગુસ્લકા મતલબ નહાના હૈ, મગર નહાનેકા શરીઅતમેં એક ખાસ તરીકા હૈ. ગુસ્લકા તરીકા યહ હૈ કે પેહલે દોનોં હાથ ધો કર ઇસ્તિંજા કરે ઔર બદનસે હડીકી નજાસત ધો ડાલે. ફિર વુઝૂ કરે, ફિર તમામ બદન પર પાની ડાલ કર હાથસે યા સાખુન લગા કર મલે. ફિર સારે બદન પર તીન મરતખા પાની બહાએ. કુલ્લી કરે ઔર નાકમેં પાની ડાલે.

બેહતર યહી હૈ કે ગુસ્લ હમ્મામ યા ગુસ્લખાનેમેં કિયા જાએ. હમ્મામ યા ગુસ્લખાનેમેં પૂરે કપડે ઉતાર કર નહાયા જા સકતા હૈ, લેકિન હમ્મામ કા ઈન્ટેજામ ન હો તો ફિર નાફસે ઘુટનોં તક કપડા બાંધકર નહાના ચાહિયે.

જ્યાદા પાની બહાના, સત્ર ખુલા હોનેકી સૂરતમેં બાતચીત કરના યા કિબ્લેકી તરફ મુંહ કરના ઔર સુન્નાતકે ખિલાફ ગુસ્લ કરના મકરૂહ હૈ.

## ગુસ્લ કબ વાજિબ હોતા હૈ ?

(૧) સોતે યા જાગતેમેં જબ જવાનીકે જોશકે સાથ મની નિકલ આયે, જિસે એહેતેલામ કેહતે હું, તો ગુસ્લ વાજિબ હો જાતા હૈ.

(२) जब मर्दकी पेशाबगाहका अगला हिस्सा जिसे सुपारी कहते हैं औरतकी शर्मगाहमें दाखिल हो जाए और छुप जाए तो गुस्सा वाजिब हो जाता है याहे मनी निकले या न निकले.

(३) औरतोंको जो खून हर महीने शर्मगाहसे आता है उसे हैज़ कहते हैं, जब ये खून आना बंद हो जाए तो गुस्सा करना वाजिब है.

(४) औरतको बच्चा पैदा होनेके बाद जो खून आता है उसको निफास कहते हैं, उसके बंध होने पर गुस्सा करना वाजिब है.

नोट: सोनेके बाद आंख खुली और कपड़े या बदन पर मनी लगी हुई हो तो भी गुस्सा वाजिब हो जाता है याहे कोई खवाब देखा हो या न देखा हो.

### गुस्साके फ्राइम :

- (१) कुल्ली करना।
- (२) नाकमें पानी डालना।
- (३) तमाम बदन पर पानी डालना।

### गुस्समें पांच सून्नतें हैं :

- (१) धोनों हाथ गह्नों तक धोना।
- (२) ईस्तिंज़ा करना और जिस जगह नज़सत लगी हो उसको धोना।
- (३) नापाकी दूर करनेकी नीयत करना।
- (४) पेहले वुजू करना।
- (५) पूरे बदन पर तीन बार पानी बहाना।

## વુગ્રૂકા બચાવનાન :

જબ નમાઝ પઢનેકા ઈરાદા કર લે તો સાફ બર્તનમાં પાક પાની લેકર પેહલે ગણો તક હાથ ધોએ, ફિર તીન બાર કુલ્લી કરે, મિસ્વાક કરે, ફિર તીન બાર નાકમાં પાની આલે ઔર નાક સાફ કરે, તીન બાર મુંહ ધોએ, ફિર કોહનિયોં તક દોનોં હાથ ધોએ, ફિર સર ઔર કાનોંકા મસહ કરે, ફિર દોનોં પાંવ ટખનોં તક ધોએ.

## વુગ્રૂમાં ચાર ફર્જ હોય :

- (૧) પેશાનીકે બાલોંસે ઠોડીકે નીચે તક ઔર એક કાનસે દૂસરે કાન તક મુંહ ધોના
- (૨) દોનોં હાથોંકો કોહનિયોં સમેત ધોના
- (૩) ચોથાઈ સરકા મસહ કરના
- (૪) દોનોં પાંવ ટખને સમેત ધોના

## વુગ્રૂમાં તેરણ સુણતેં હોય :

- (૧) નીચ્યત કરના
- (૨) બિસ્મિલ્હાઅ પઢના
- (૩) પેહલે તીન બાર દોનોં હાથ ગણો તક ધોના
- (૪) મિસ્વાક કરના
- (૫) તીન બાર કુલ્લી કરના
- (૬) તીન બાર નાકમાં પાની આલના

- 
- (७) दाढ़ीका जिलाल करना।
  - (८) हाथ- पांवकी उंगलियोंका जिलाल करना।
  - (९) हर उङ्गलीको तीन बार धोना।
  - (१०) एक बार पूरे सरका मसह करना। यानी भीगा हुवा हाथ फेरना।
  - (११) दोनों कानोंका मसह करना।
  - (१२) तरतीबसे वुजू करना।
  - (१३) पै दर पै वुजू करना के एक उङ्गल सूखने न पाए के दूसरा धोए।

### वुगूमें पांच बातें मुस्तहब हैं :

- (१) दाढ़े तरफसे शुरू करना।
- (२) गर्दनका मसह करना।
- (३) दूसरेकी मददके बगैर खुद वुजू करना।
- (४) किलेकी तरफ मुंह करके बेठना।
- (५) पाक और गिरी जगह पर बेठ कर वुजू करना।

### वुगूमें चार चीजें मकड़ह हैं :

- (१) नापाक जगह पर वुजू करना।
- (२) सीधे हाथसे नाक साफ़ करना।
- (३) वुजू करनेमें दुनियाकी बातें करना।
- (४) सुन्हतके जिलाफ़ वुजू करना।

## આઠ બાતોંસે વુગ્ગુ ટૂટ જાતા હૈ :

- (૧) પાખાના યા પેશાબ કરના
- (૨) રિયાહકા ખારિજ હોના
- (૩) બદનકે કિસી હિસ્સેસે પીપ યા ખૂનકા નિકલ કર બેહ જાના
- (૪) મુંહ ભર કર કે (ઉલ્ટી) કરના
- (૫) લેટ કર યા સહારા લેકર સો જાના
- (૬) બીમારી યા કિસી દૂસરી વજહસે બેહોશ હો જાના
- (૭) દીવાના હો જાના
- (૮) નમાઝમે કેહ-કહા માર કર યા'ની ઝોર સે હંસના

## તયમ્બુમકા બચાન :

પાક ભિંડીસે બદનકો નજસતે હુકમિયહસે પાક કરનેકો તયમ્બુમ કહતે હૈ.

જબ પાની ન મિલે યા પાની ઈસ્તેમાલ કરનેસે બીમાર હો જાને યા બીમારી બઢ જાનેકા ખતરા હો તો બજાએ ગુસ્લ યા વુગ્ગુકે તયમ્બુમ કરના જાઈજ હૈ. મિસાલકે તૌર પર પાની એક યા દો મીલ દૂર હો, યા કિસી દુશ્મનકે ખતરેકી વજહસે અપની જાનકા ખતરા હો યા પાની મિલનેકી જગાહ પર સાંપ યા શેર યા કોઈ દૂસરા ખતરનાક દુશ્મન મોજૂદ હો ઔર ઉનકી મૌજૂદગીસે જાનકા ખતરા હો, યા કૂવા તો હૈ લેકિન ડોલ ઔર રસ્સી નહીં હૈ, યા પાની ઉસકે પાસ ઈતના કમ હૈ કે અગર વુગ્ગુ યા ગુસ્લમે ખર્ચ કર દિયા તો ઉસકે ઘાસે મરનેકા ડર હો તો ઈન સૂરતોમેં બિલા શક તયમ્બુમ કર સકતા હૈ.

पानीके ईस्तेमालसे मामूली बीमारीका खतरा हो तो तयभुम जाईज नहीं है अलबत्ता खतरनाक बीमारीका अंदेशा हो और मशहूर हडीम या डाक्टर पानीके ईस्तेमालसे मना करें तब ही तयभुम करना चाहिये।

### तयभुममें तीन फर्म हैं :

- (१) नीच्यत करना
- (२) दोनों हाथ भिड़ी पर मार कर मुंह पर फेरना
- (३) दोनों हाथ भिड़ी पर मार कर दोनों हाथोंको कोहनियों तक मलना  
(भिड़ीका साफ़ होना ज़रूरी है)

### तयभुमका तरीका यह है :

पेहले नीच्यत करे के मैं नापाकी दूर करने और नमाझ पढ़नेके लिये तयभुम करता हूँ। फिर दोनों हाथ भिड़ीके बडे ढेले पर मार कर उन्हें आड़ दे, ज्यादा भिड़ी लग जाए तो मुंहसे फूँक दे और दोनों हाथोंको मुंह पर ईस तरह भले के कोई जगह बाकी न रहे। एक बाल बराबर भी जगह छूट जाए तो तयभुम नहीं होगा। फिर दूसरी मरतबा दोनों हाथ भिड़ी पर मारे और उसे आड़ कर कोहनियों तक हाथ फेरे और उंगलियोंका भिलाल भी ज़रूरी है।

पाक भिड़ी, रेत, पथ्थर, चूना और भिड़ीके कच्चे या पक्के भरतन जिन पर रोगन या पोतिश न हो, भिड़ी की कच्ची या पक्की हिट्ट, भिड़ी, पथ्थर और चूनेकी दीवार पर तयभुम करना जाईज नहीं है।

लकड़ी, लोहा, सोना, चांदी, तांबा, पीतल, ऐत्युभिनियम, शीशा, रांग, जस्त, गेहूँ, जव और तमाम किस्मके अनाज कपड़े, राख वजौरह पर तयभुम जाईज नहीं है।

### **૩. તારકીબે નમાઝ**

૧. અગાનકા બયાન
૨. નમાઝકા બયાન
૩. નમાઝકી શર્તો
૪. નમાઝકે અરકાન
૫. વાજિબાતે નમાઝ
૬. નમાઝકી સુન્નતો
૭. મુફસિદાતે નમાઝ
૮. મકરૂહાતે નમાઝ
૯. નમાઝકે અવકાત
૧૦. નમાઝ પણેકા તરીકા-તારકીબ

સજ્જદાએ સહૃદવકા બયાન

વિત્રકી નમાઝ

નમાઝે તરાવીષ

બીમારકી નમાઝ

મુસાફિરકી નમાઝ

જુમાકી નમાઝ

ઇદેનકી નમાઝ

જનાઓકી નમાઝ

## ૧. અગ્રાનકા ભયાન :

અજાનકે મા'ની ખબર કરનેકે હૈનું, લેકિન શરીઅતમે ફર્જ નમાઝોકે લિયે જો ખાસ અલફાઝ ખબર કરનેકે લિયે પુકારે જાતે હોય તેઓ અજાન કહા જાતા હૈ.

અજાનસે ઈસ્લામની એક ખાસ શાન ઝાંછિર હોતી હૈ ઈસ લિયે ઈસકી બહોત જ્યાદા તાકીદ હૈ.

પાંચોં ફર્જ નમાઝો ઔર જુમ્માકી નમાઝકે લિયે અજાન મસ્નૂન હૈ, ઈસકે અલાવા ઔર કિસી નમાઝકે લિયે અજાન મસ્નૂન નહીં.

હર ફર્જ નમાઝકી અજાન ઉસકે વકતમે કેદની ચાહિયે.

## અગ્રાનકે અલ્ફાગ ચહું હોય :

અલ્ફાઝ અકબર

اللَّهُ أَكْبَرُ

(ચાર બાર પુકારે)

અશ્હાદુઅલ્લ લા ઈલાહ ઈલ્હાલ્

أَشْهَدُ أَنَّ لِلَّهِ إِلَّا اللَّهُ

(દો બાર પુકારે)

અશ્હાદુઅના મુહમ્મદર

أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ

રસૂલુલ્હાહ

(દો બાર પુકારે)

હૈયા અલસ્સલાહ

حَيَّ عَلَى الصَّلَاةِ

(દો બાર પુકારે)

## حَقِّي عَلَى الْفَلَاج

ਹੈਥਾ ਅਲਲਾਹ ਫਲਾਹ

(ਦੋ ਬਾਰ ਪੁਕਾਰੋ)

ਅਲਲਾਹੁ ਅਕਬਰ

اللَّهُ أَكْبَرُ

(ਦੋ ਬਾਰ ਪੁਕਾਰੋ)

ਲਾ ਈਲਾਹ ਈਲਲਾਹ

لَا إِلَهَ إِلَّا اللَّهُ

ਨੋਟ: ਫਜ਼ਕੀ ਨਾਮੋਂਝਕੇ ਲਿਖੇ ਜੋ ਅਜਾਨ ਪੁਕਾਰੀ ਜਾਤੀ ਹੈ ਉਸਮੇਂ ਹੈਥਾ ਅਲਲਾਹ ਫਲਾਹ ਕੇ ਬਾਅਦ

ਅਸਲਾਤੁ ਐਰੂਮ ਮਿਨਨ ਨਾਮ

الصَّلَاةُ خَيْرٌ مِّن النَّوْمِ

(ਨਮਾਜ਼ ਨੀਵਾਂ ਬੇਹਤਰ ਹੈ) (ਦੋ ਬਾਰ ਪੁਕਾਰੋ)

ਅਜਾਨ ਕੇ ਬਾਅਦ ਧੂਆਪਣੀ ਚਾਹਿਏ :

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدُّعَوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ  
الْقَائِمَةِ أَتِ مُحَمَّدًا الْوَسِيلَةُ وَالْفَضِيلَةُ  
وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا إِلَيْهِ الْذِي وَعَدْتَهُ  
إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ

ਅਲਲਾਹੁ ਮਿਨ ਰਘੂ ਹਾਜ਼ਿਹਿਦ ਦ'ਅਵਤਿਰ ਤਾਮ੍ਰਮਤਿ ਵਸ਼ਲਾਤਿਲ ਕਾਈਮਤਿ  
ਆਤਿ ਸੁਹਮਦ ਨਿਲਵਸੀਲਤ ਵਲ ਫ਼ਗੀਲਤ ਵਖ਼ਾਸਹੁ ਮਕਾਮਮ ਮਹਮੂਦ  
ਨਿਲਖੀ ਵ ਅਦਤਹੁ ਈਨਕ ਲਾ ਤੁਖ਼ਲਿਕੁਲ ਮੀਆਦ.

## ૨. નમાજકા બયાન :

ચોભીસ ધંટોમંને પાંચ નમાજેં ફરજ હુંદેં. ઈનકો છોડનેવાલા સખ્ત ગુનેહગાર, ફાસિક ઔર ફાજિર હે ઔર ઈનકી ફરજિયતકા ઈન્કાર કરનેવાલા કાફિર હે.

‘ફતવા એ આલમગીરી’મંને હું કે જો શાખ્સ નમાજકી ફરજિયતકા ઈન્કાર નહીં કરતા લેકિન જાનભૂગ કર નમાજ છોડ દેતા હું ઉસકો કત્લ ન કરેં બલ્કે કેદ કર દેં, યથાં તક કે વહ તૌબા કરે.

પાંચ નમાજેં હર મુસલમાન, બાલિગ, મર્દ ઔર ઔરત પર ફરજ હુંદેં, ઝુહર, અસર, મગરિબ, ઈશા.

## ૩. નમાજકી શર્તોઃ

નમાજ સહી ઔર મુકભ્મલ હોનેકે લિયે સાત શર્તોં હુંદેં. અગર ઈનમંસે એક ભી શર્ત પૂરી ન હુદ્દી તો નમાજ ન હોયા. વહ શર્તોં યદ્દું હુંદેં :

૧. બદનકા પાક હોના ઔર ગુસ્લકી ઝરૂરત હો તો ગુસ્લ કરના ઔર વુગૂકી ઝરૂરત હો તો વુગૂ કરના

૨. કપડોંકા પાક હોના

૩. નમાજકી જગહકા પાક હોના

૪. સત્રકા છુપાના

૫. નમાજકા વકત હોના

૬. કિબલેકી તરફ મુદ્દ હોના

૭. નીથ્યત કરના

૧. બદનકે પાક હોનેસે મુરાએ યદ્દું હું કે અગર ગુસ્લ વાજિબ હો તો ગુસ્લ કરે. બદન પર કિસી જગહ નાપાકી લગી હો તો ઉસકો ધો કર સાફ

---

કરે ઔર વુગ્યૂ કરે.

૨. નમાજકી દૂસરી શર્ત યહ હૈ કે કપડે પાક હોં, અગર કોઈ શખ્સ બિલા ઉજ્જર નાપાક કપડોંસે નમાજ પઢેગા તો નમાજ ન હોગી ઔર ગુન્હેગાર હોગા. કપડોંસે મુરાદ વહી કપડે હૈને જિનકો પેહનકર નમાજ પઢી જાતી હૈ જેસે કમીજ, કુર્તા, પાણમા, પેન્ટ, લુંગી, દુપણા, શેરવાની, કોટ, અમામા વગૈરહ.... ઈનમોંસે કિસી પર અગર એક દિરહમ (એક રૂપિયા કલદાર) કે બરાબર યા ઉસસે જ્યાદા નજસત લગી હો તો કપડેકા પાક કરના જરૂરી હૈ.

નજસતે ખફીઝા ૧ કપડેકે ચોથાઈ છિસ્સે યા ઉસસે જ્યાદા પર હો તો ઉનકા પાક કરના ભી જરૂરી હૈ.

૩. જગહકે પાક હોનેકા યે મતલબ હૈ કે જિસ જગહ નમાજ પઢી જાએ ઉસ જગહકા પાક હોના જરૂરી હૈ, જેસે તખ્ત, જાનમાજ ઔર વહ કપડા જિસ પર નમાજ પઢી જાએ.

૪. સત્રકે છુપાનેસે મુરાદ યહ હૈ કે મર્દકો નાફસે ઘુટનોં તક અપના બદન છુપાના ફર્જ હૈ. યહ ઐસા ફર્જ હૈ કે નમાજકે અંદર ભી ફર્જ હૈ ઔર નમાજકે બાહર ભી ફર્જ હૈ. કુછ લોગ જો નીકર યા ચડી પહન કરી બાહર ફિરતે હૈને ગુનાહ હૈ. ઔરતકો સિવાય દોનોં હથેલિયોં, પાંવ ઔર મુંહકે, પૂરે બદનકા ઢાંકના ફર્જ હૈ. અગરચે ઔરતકો નમાજમે મેં મુંહ છુપાના ફર્જ નહીં હૈ લેકિન ગેરમદોંકિ સામને બેપરદા આના ભી જાઈજ નહીં હૈ.

૫. નમાજ પઢનેકે લિયે યહ શર્ત હૈ કે જો વકત ઈસકે લિયે મુકર્રર કિયા ગયા હૈ ઉસી વકતમેં પઢી જાએ. વકતસે પેહલે પઢેગા તો નમાજ નહીં હોગી, વકતકે બાદ પઢનેસે અદા નહીં બલ્કે કઝા હોગી. જેસે જુહરકા વકત બાકી હૈ ઔર અસ્તકા વકત નહીં હુવા ઔર કિસીને જુહરકે વકત હી મેં અસ્તકી નમાજ પઠ લી તો અસ્તકી નમાજ ન હોગી. યા જુહરકા વકત ગુજર ગયા ઔર અસ્તકા વકત શુરૂ હો ગયા ઔર કિસીને જુહરકી નમાજ

न पढ़ी तो पेहले गुहरकी नमाज करा पठ ले फिर अज्ञकी नमाज बाजमाअत पढ़े. तंग वक्तमें नमाज पढ़ना मुश्विर है.

६. इसको इस्तिक्खाले किब्ला भी केहते हैं, इसका मतलब ये है कि नमाज पढ़नेवालेका मुँह किब्लेकी तरफ हो. मुसलमानोंका किब्ला खानाए का'बा कमरेकी शक्लका एक धर है कि जो मुँहे अरबके मशहूर शहरेर मक्का मुअर्रजमामें वाकेअ है. खानाए का'बा को का'बतुल्लाह, बयतुल्लाह और बयतुलहराम भी केहते हैं.

हमारे मुल्क हिंदुस्तान, बर्मा, पाकिस्तान और दूसरे बहुतसे मुल्कोंमें किब्ला मन्त्रिभक्ती तरफ है.

झर्झ और नक्ल नमाजें, इटेनकी नमाजें, जनामेकी नमाज और सज्जदए तिलावत किब्लेकी तरफ मुँह किये बगैर जाईज नहीं.

७. नीयत दिलसे ईरादेको केहते हैं, भिसालके तौर पर झज्जी नमाज पढ़नी है तो ये नीयत करे के आजकी नमाजे झज्ज पढ़ता हूँ. करा नमाज हो तो इस तरह नीयत करे के फलां इनकी नमाजे झज्ज पढ़ता हूँ. अगर ईमामके पीछे नमाज पढ़ता हो तो उसकी नीयत भी ज़रुरी है. नक्ल नमाज, सुन्नत नमाज और तरावीहके लिये भी नीयत करना ज़रुरी है. नीयत अगर जबानसे न करे तो नीयत हो जाएगी लेकिन जबानसे केहना मुस्तहब है.

#### ४. नमाजके अरकान :

अरकाने नमाज उन चीजोंको केहते हैं जो नमाजके अंदर झर्झ हैं. अरकान तुक्नकी जमा है, तुक्नके मानी झज्जिकी और अरकानका मतलब फराईज हैं.

#### नमाजके अंदर ४ बातें झर्झ हैं :

(१) तकधीरे तहरीमा केहना

- (२) કયામ યા'ની ખડા હોના
- (૩) કિર્ખત યાની કુર્ચાન મજૂદમેંસે કુછ પઢના
- (૪) રુક્ષૂઅ કરના
- (૫) દોનોં સજદે કરના
- (૬) કાયદાએ અખીરહ
- (૧) તકબીરે તહરીમાકા યહ મતલબ હૈ કે નીચ્યત બાંધતે વકત અલ્લાહુ અકબર કહે. ઈસ તકબીરકે કેહનેસે નમાજ શુરૂ હો જતી હૈ ઔર જો બાતે નમાજકે જિલાફ હૈનું; જેસા કે ચલના-ફિરના, ખાના-પીના ઔર બાતચીત કરના વગેરહ સબ કુછ હરામ હો જતા હૈ, ઈસકો તકબીરે તહરીમા કેહતે હૈનું. તકબીરે તહરીમા કેહતે વકત ફર્જ ઔર વાજિબ નમાજોમેં જબ કે કોઈ ઉઝુર ન હો સીધા ખડા હોના ફર્જ હૈ.
- (૨) કયામ ખડે હોનેકો કેહતે હૈનું ઔર ખડે હોનેસે ઐસા સીધા ખડા હોના મુરાદ હૈ કે ધુટનોં તક છાથ ન પહોંચ સકેં.
- ફર્જ ઔર વાજિબ નમાજોમેં ઈતના ખડા હોના ફર્જ હૈ જિસમેં ઈતના કુર્ચાન પઠ લિયા જાએ જિતના કે નમાજમેં પઢના ફર્જ હૈ.
- નફ્ફલ નમાજે બૈઠ કર પઢી જા સકતી હૈનું. બીમારીકી હાલતમેં જખી હોનેકી હાલતમેં ઔર ખડે હોનેકી તાકત ન હો તથ નમાજ બૈઠકર ભી પઢી જા સકતી હૈનું.
- (૩) નમાજમેં કુર્ચાનેમજૂદ પઢનેકો કિર્ખત કેહતે હૈનું. કમ અણ કમ એક આયત પઢના ફર્જ હૈ. સૂરઃ ફાતિહા પઢના, વાજિબ હૈ. ફર્જકી પેહલી ઔર દૂસરી રક્ખાતોં ઔર નમાજે વિત્રમેં, સુન્નત ઔર નફ્ફલકી તમામ રક્ખાતોંમેં સૂરઃ ફાતિહાકે બાદ કોઈ ઔર સૂરત યા એક બડી આયત યા કમસે કમ તીન છોટી આયતોંકા પઢના વાજિબ હૈ.

---

ફર્જ નમાઝકી તીસરી રક્ખાત ઔર ચોથી રક્ખાતકે અલાવા સુન્નત, વિત્ર ઔર નફ્ફલકી હર રક્ખાતમેં સૂરા: ફાતિહાકે બાદ કુર્અન્કા પઢના ફર્જ હૈ.

(૪) તુકૂઅ, નમાઝમેં ઈસ કદર જુકનેકો કેહતે હોએ કે હાથ ધુટનોં તક પહોંચ જાએ. તુકૂઅકા મસ્નૂન તરીકા યહ હૈ કે ઈતના જુકા જાએ કે સર ઔર કમર બરાબર રહેણે ઓર હાથ પસલિયોસે અલગ રહેણે. ઓર ધુટનોંકો દોનોં હાથોસે પકડ લિયા જાએ. બુઢાપેકી વજહસે કમર ઈસ કદર જુક જાએ યા બહુત જ્યાદા કુબડા હો કે તુકૂઅકી શકલમેં હર વકત માલૂમ હોતા હો. તો વો સર કે ઈશારેસે યા સરકો જુકા કર તુકૂઅ કરે.

(૫) જમીન પર પેશાની રખનેકો સજ્જદહ કેહતે હૈ. હર રક્ખાતમેં દોનોં સજ્જદે ફર્જ હૈને. અગર પેશાની ઔર નાક દોનોં પર જખ્મ હો તો ઐસે ઈન્સાનકો સરકે ઈશારેસે સજ્જદહ કર લેના ચાહિયે.

એક સજ્જદહકે બાદ દૂસરા સજ્જદહ કરનેસે પેહલે અચ્છી તરફ સીધા હોકર બેઠે ઔર કિર દૂસરા સજ્જદહ કરે.

(૬) કઅંદાએ અખીરામેં અતાહિયાતકે આખરી લક્ષ્ય અંજુહુ વ રસૂલુહ તક પઢનેકી મિકદાર બૈઠના ફર્જ હૈ.

કઅંદાએ અખીરા તમામ નમાઝોમેં ચાહે ફર્જ હો, વાજિબ હોએ સુન્નત હો યા નફ્ફલ ફર્જ હૈ.

#### ૫. વાજિબાતે નમાઝ :

વાજિબાતે નમાઝ ઉન બાતોંકો કેહતે હૈનેકા નમાઝમેં અદા કરના અરૂરી હૈ. અગર ઈનમેસે કોઈ ચીજ ભૂલસે છૂટ જાએ તો સજ્જદહએ સહ્યવ કર લેનેસે નમાઝ દુરુસ્ત હો જાતી હૈ, ઔર ભૂલસે છૂટનેકે બાદ સજ્જદહએ સહ્યવ ન કિયા જાએ યા જાનબૂજ કર કોઈ બાત છોડ દી જાએ તો નમાઝકા ટૂટના વાજિબ હો જાતા હૈ.

## વાજિબાતે નમાજ ચોદહ હું :

- (૧) ફરજ નમાજકી પેહલી દો રક્ખાતોં કિર્ભતકે લિયે મુકર્રર કરના.
- (૨) ફરજ નમાજોંકી તીસરી ઔર ચોથી રક્ખાતમેં સિઝ સૂરઃ ફાતિહા પઢના, લેકિન સુન્નત, વાજિબ ઔર નફ્ફલ નમાજકી તમામ રક્ખાતોંમેં સૂરઃ ફાતિહાકે બાદ કોઈ સૂરઃ યા બડી આયત યા કમસે કમ તીન છોટી આયતોંકા પઢના.
- (૩) સૂરઃ ફાતિહાકો સૂરઃ સે પેહલે પઢના.
- (૪) કિર્ભત ઔર રુક્ખુઅમેં ઔર સજદોં ઔર રક્ખાતોંમેં તરતીબ કાયમ રખના.
- (૫) કોમા કરના યા'ની રુક્ખુઅસે ઉઠકર સીધા ખડા હોના.
- (૬) જલ્લા યાની દોનોં સજદોંકે દરમ્યાનનેં સીધા બેઠ જાના.
- (૭) તઅદીલે અરકાન યા'ની રુક્ખુઅ, સજદહ વગૈરહકો ઇત્મીનાનસે અચ્છી તરહ અદા કરના.
- (૮) દોનોં કભ્રદોમેં તશાહ્દુદુદ પઢના.
- (૯) ઇમામકો નમાજે ફજ, મગારિબ, ઈશા, જુમ્બા, ઈદૈન, તરાવીહ ઔર રમઝાનુલ મુબારકકે વિત્રોમેં આવાજસે કિર્ભત કરના ઔર જુહર ઔર અચ્છકી નમાજોમેં આહિસ્તા પઢના.
- (૧૧) લઙ્જ સલામકે સાથ નમાજકો ખત્મ કરના.
- (૧૨) નમાજે વિત્રમેં કુનૂતકે લિયે તકબીર કેણા ઔર દુઆએ કુનૂત પઢના.
- (૧૩) દોનોં ઈદૈનકી નમાજોમેં જાઈદ તકબીરેં કેણા.

## ६. नमाझकी सुन्नतें :

जो चीज़ों नमाझमें हज़रत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लमसे साभित हुई हैं लेकिन उनकी ताकीद फ़र्ज और वाञ्छिबके भराभर साभित नहीं हुई उन्हें सुन्नत कहते हैं, इन चीज़ोंमें कोई चीज अगर भूलेसे छूट जाए तो न नमाझ टूटती है न सज्दाए सख्त वाञ्छिब होता है, न गुनाह होता है. और जानबूझकर छोड़ देनेसे नमाझ तो नहीं टूटती और न ही सज्दाए सख्त वाञ्छिब होता है. लेकिन छोड़नेवाला मलामतका मुस्ताहिक होता है.

## नमाझमें यह सुन्नतें हैं :

- (१) तक्बीरे तेहरीमा केहनेसे पेहले दोनों हाथ कानों तक उठाना।
- (२) दोनों हाथोंकी उंगलियां अपने हाल पर खुली रखना और किल्ला रुख रखना।
- (३) तक्बीर केहते वक्त सरको न लुकाना।
- (४) इमामका तक्बीरे तेहरीमा और एक रुक्नसे दूसरे रुक्नमें जानेकी तमाम तक्बीरें बुलन्द आवाज़से केहना।
- (५) सीधे हाथको बायें हाथ पर नाफ़के नीचे बांधना।
- (६) सना पढ़ना।
- (७) अउगुबिल्लाह पढ़ना।
- (८) बिस्मिल्लाह पढ़ना।
- (९) फ़र्ज नमाझकी तीसरी और चोथी रक्खातमें सिई सूरः शातिखा पढ़ना, आमीन केहना।
- (१०) सना, तअव्युज और बिस्मिल्लाह और आमीन सबको पढ़ना।

(११) सुन्नतके मुताबिक इर्थत करना या'नी जिस नमाजमें जिस कदर कुर्अनेमण्ड पढना सुन्नत है उसके मुताबिक पढना।

(१२) तुकूअ और सज्देमें तीन तीन बार तस्बीह पढना।

(१३) लकूअमें जुकने और घुटनों पर हाथ रखनेसे फर्ज अदा हो जाता है। सुन्नत यह है कि तुकूअमें कमर सीधी हो, न नीचेकी तरफ जुकी हुई, न तो ऊपर उठी हुई। हाथ घुटनों पर रखते वक्त कोहनियोंको बदनसे दूर रखें और घुटनों पर उंगलियां खोल कर रखें।

(१४) कोमामें ईमामको सभिअल्लाहुलिमन हमिदह और मुक्तादीको रथना लकलहमद केहना और मुन्झरिदको (अकेले नमाज पढनेवाला) दोनों केहना।

(१५) सज्देमें जाते वक्त पेहले दोनों घुटने, फिर दोनों हाथ, फिर पेशानी जमीन पर रथना। सज्देसे उठते वक्त पेहले हाथ जमीनसे उठाना, फिर घुटने उठाना। सज्देमें (१) बाजुओंको पेहलूओंसे दूर रखें। (२) कोहनियोंको उठाए रखें (कुतोकी तरह हाथ न केलाएं) (३) उंगलियां भिली हुई रखें (४) दोनों हाथ मूँछे और कानोंके बराबर रखें। (५) हाथ और पांवकी उंगलियोंको डिल्ला रुख रखें। (६) पेटको रानोंसे दूर रखें (औरत) रानों ओर पेट को भिलाएं।

(१६) जल्सा और कञ्चूदमें बांया पांव बिछा कर उस पर बेठना और सीधे पांवको ईस तरह खड़ा रथना के उसकी उंगलियोंके सिरे डिल्लेकी तरफ रहें और दोनों हाथ दोनों रानोंको भिलाकर बांये पांवको ढायी रानके नीचे रखें।

(१७) तशहूहुदमें 'अशहू अलू ला ईलाह' पर कलमेकी उंगली उठाएं और 'ईल्लल्लाह' पर रथ लें।

(१८) कञ्चूदसे अधीरा तशहूहुदके बाद हुडूद पढना।

(१९) हुडूदके बाद हुआ पढना।

---

(२०) પેહલે દાઓં તરફ ફિર બાઓં તરફ સલામ ફેરના.

## ૭. મુફ્તસિદ્ધાતે નમાજ :

મુફ્તસિદ્ધાતે નમાજ ઉન ચીજોંકો કેહતે હું જિનસે નમાજ ફાસિદ હો જતી હૈ યા'ની ટૂટ જતી હૈ ઔર ઉસે લૌટાના જરૂરી હો જતા હૈ.

મુફ્તસિદ્ધાતે નમાજ યે હૈ :

(૧) નમાજમણે બાતચીત કરના, ચાહે ભૂલ કર હો યા જાનબૂજ કર, થોડા હો યા જયાદા નમાજ ફાસિદ હો જતી હૈ.

(૨) સલામ કરના, સલામકા જવાબ દેના, છીંકકા જવાબ દેના, નમાજસે બાહર કોઈ શખ્સ દુઆ માંગ રહા હૈ ઉસકી દુઆ પર આમીન કેહના.

(૩) કિસી બુરી ખબર પર ઈન્ના લિલ્લાહ.... કેહના યા અથી ખબર પર સુષ્ણાનલ્લાહ કેહના.

(૪) દર્દ યા રંજકી વજહસે ઊંઘકાર ભરના.

(૫) અપને ઈમામકે સિવા કિસી દૂસરેકો લુકમા દેના.

(૬) કુર્અનિશરીફ દેખ કર પઢના.

(૭) કુર્અનેમજ્ઞદ પઢનેમણે સખત ગલતી કરના.

(૮) અમલે કસીર કરના યા'ની કોઈ ઐસા કામ કરના જિસકી વજહસે લોગ યે સમજે કે યે ઈન્સાન નમાજ નહીં પઢ રહા હૈ.

(૯) ખાના-પીના ચાહે ભૂલ કર હો યા જાનબૂજ કર.

(૧૦) દો સફોંકી મિકદારકે બરાબર ચલના.

(૧૧) કિબલેકી તરફસે બિલા ઉઝ્જર અપના સીના ફેર લેના.

(૧૨) નાંપાક જગહ પર સજદહ કરના.

- 
- (१३) सत्रर भुल जानेकी सूरतमें एक तुड़नकी मिक्दार ठहरना।
- (१४) हुआमें ऐसी चीज़ मांगना जो बंदोंसे मांगी जाती है जैसे अप अल्लाह मुझे आज सो रुपिये दे हे।
- (१५) मुसीबतकी वजहसे ईस तरह रोना के आवाजमें हुरुक आहिर छोने लगें।
- (१६) बालिगका नमाझमें कहकहा मार कर या झोरसे हंसना।
- (१७) ईमामसे आगे बढ़ जाना।

### वो चीजें जिनसे नमाझ नहीं टूटती :

- (१) रोना: खशीथते ईलाही या बीमारीकी वजहसे अगर रोना आ जाए भगर दो हरफों तकके लिये हो तो।
- (२) घंभारना: अदृत पर घंभार सकतें हैं भगर दो हरफोंसे ज्यादा नहीं।
- (३) ईल्लिशात (किसी तरफ़ तवज्ज्ञेष देना): इर्ज नमाझके अलावा मजबूरी हो तो किया जा सकता है।
- (४) सांप, बिर्चु, मध्यी (उंखवाली) और झेहरीले और नुकसानदेह जानवरोंको मार सकते हैं।
- (५) साप्त झड़रतके वक्त थोड़ा सा यलना।
- (६) बच्चे या बच्चीको उठाना।
- (७) नमाझ पढ़ते हुए कोई ऐसी चीज़ पेश आए जिस पर टोकना या मुतनज्जेह करना पड़े (ईमाम नमाझमें गलती करे) तो मर्द सुष्णान्‌ल्लाह कहें। औरतें दाढ़ों छाथकी उंगलियां बाईं हथेली पर मार कर ताली बजाएं।
- (८) ईमाम अगर नमाझमें कुर्बान पढ़नेमें भूल करे तो लुकमा देना।

- 
- (૮) જૂતેકે સાથ નમાજ પછના, મગર જૂતે પાક હોય.
- (૯) દિલમેં ઈધર-ઉધરકે ઘ્યાલ આના.
- (૧૦) આંખોં બંદ કરના.
- (૧૧) ખુશૂઅ-વ-ખુઝૂકે લિયે નંગે સર નમાજ પછના, સુસ્તીસે હો તો મકરૂહ હોય.

## ૮. મકરૂહાતે નમાજ :

- મકરૂહાતે નમાજ યહ હોય, ઈનકી વજહસે નમાજ કરાહતકે સાથ હોગયી.
- (૧) સદલ યા'ની કપડે લટકાના જૈસે ચાદર સર પર ડાલકર ઉસકે દીનો કિનારે લટકા દેના ઔર શેરવાની યા કોટ બગેર પેહને કંધો પર ડાલકર લટકા લેના.
- (૨) કપડોંકો મિઠીસે બચાનેકે લિયે મિઠીકો ઈધર-ઉધર કરના ઔર કપડે ઝટકારના.
- (૩) અપને કપડોં યા બદનસે ખેલના.
- (૪) મામૂલી ઔર મેલે કપડોંસે નમાજ પછના.
- (૫) મુંહમેં રૂપિયા યા પૈસા રખના જિસકી વજહસે કુર્ચાન પછના મુશ્કિલ હો જાએ.
- (૬) સુસ્તી ઔર બેપરવાહીકી વજહસે નંગે સર નમાજ પછના.
- (૭) પાખાના યા પેશાબકી હાજતમેં નમાજ પછના.
- (૮) બાલોંકો સરપર રખ કર ચુટિયા બાંધના જૈસે સિખ ઔર હિંદુ સાધુ બાંધ લેતે હોય.
- (૯) કંકરિયોંકો હટાના; લેકિન અગાર સજદષ કરના મુશ્કિલ હો તો એક મરતબા હટાનેમેં કોઈ હરજ નહીં હૈ.

- 
- (१०) उंगलियां चटखाना, एक हाथकी उंगलियां दूसरे हाथकी उंगलियोंमें डालना, कमर, कुप्र या कुल्हे पर हाथ रखना.
- (११) डिब्बेकी तरफसे मुँह फेर कर या सिर्फ आंखोंसे ईधर-उधर देखना.
- (१२) कुतेकी तरह बेठना.
- (१३) सज्जदेमें दोनों हाथोंको बिछा लेना मर्दांकि लिये मकरूह है.
- (१४) किसी औसे आदमीकी तरफ नमाझ पढना जो नमाझीकी तरफ मुँह डिये बेठा हो.
- (१५) हाथ या सरके ईशारेसे सलामका जवाब देना.
- (१६) बिला उङ्गर आलती-पालती पलाठी- मारकर बेकना.
- (१७) कसदन जम्हार्द (बगासु खावुं) लेना.
- (१८) आंखको बंद करना लेकिन अगर नमाझमें दिल लगानेके लिये बंद करे तो मकरूह नहीं.
- (१९) ईमामका मेहराबके अंदर बेठना लेकिन अगर पांव मेहराबके बाहर हो तो मकरूह नहीं.
- (२०) अडेले ईमामका एक हाथ ऊची जगह पर खड़ा होना लेकिन अगर उसके साथ कुछ मुक्तदी भी हो तो मकरूह नहीं.
- (२१) ऐसी सँझके पीछे खड़े होना जिसमें जगह खाली हो.
- (२२) किसी जानदारकी तसवीर वाले कपड़े पेहनकर नमाझ पढना.
- (२३) ऐसी जगह नमाझ पढना के नमाझीके सरके उपर, या उसकी सीधी तरफ, या उलटी तरफ, या सज्जदेकी जगह जानदारकी तसवीर हो.
- (२४) आयतें, सूरतें या तस्बीहें उंगलियों पर शुमार करना.

(२५) चाढ़र या कपड़ा ईस तरह लपेट कर पढ़ना के बाथ जल्दी न निकल सके.

(२६) नमाझमें अंगडाई लेना.

(२७) सुन्नतके खिलाफ़ नमाझमें कोई काम करना.

### नमाझकी रक्खतें:

हिन-रातमें पांच नमाजें फर्ज हैं, लेकिन फज्जि अलावा पांच नमाजोंके साथ पेहले या बादमें कुछ सुन्नत और नक्ल नमाजें भी पढ़ी जाती हैं जिनकी तक्षसील नीचे दी जा रही है :

नमाझ	रक्खत	सुन्नत	फर्ज	सुन्नत	नक्ल
	(फर्जसे पेहले)			(फज्जि बाद)	
फज्जि	४	२	२	-	-
शुहर	१२	४	४	२	२
अस्त्र	८	४	४	-	-
भगवान्निब	७	-	३	२	२
ईशा	१७	४	४	२	२

वित्र वाजिब ३

नक्ल २

### जुम्मा:

जुम्मामें कुल १४ रक्खतें हैं :

४ सुन्नत, २ फर्ज, ४ सुन्नत, २ सुन्नत, और २ नक्ल

## ૬. નમાજકે અવકાત :

૧. ફજ : ફજકા વકત સુખ્ષ સાદિકકે તુલૂઅ હોનેસે લેકર સૂરજ કે તુલૂઅ હોને તક હૈ. ઈમામ અભૂ હનીફા રહ.કે નગરીક સુખ્ષકી નમાજકા ‘અસ્ફાર’ (જબકે રોશની ફેલ જાએ)મેં પઢના અફઝલ હૈ યા’ની તુલૂઅ આફિતાબસે ઈતના પેહલે કે કિસી વજહસે નમાજ દોબારા પઢની પઢે તો મસ્જુન તરીકે પર વુજૂ કરને ઓર ઈત્ત્મીનાનસે નમાજ પઢનેકા વકત બાકી હો.

ઈમામ શાફુદી રહ., ઈમામ માલિક રહ. ઔર ઈમામ અહમદ બિન હંબલકે નગરીક ફજકી નમાજ ‘ગલસ (અંધેરેમેં) પઢના અફઝલ હૈ.

૨. ગુહર : ગુહરકી નમાજકા વકત સૂરજકે જવાલકે સાથ શુરૂ હો જાતા હૈ ઓર ઉસ વકત તક રહતા હૈ જબ હર ચીજકા સાચા ઉસકે બરાબર હો જાએ. (જવાલકા વકત માલૂમ કરનેકે લિયે ખુલ્લી ઔર હમવાર જમીનમેં જવાલસે પેહલે એક લકડી ગાડ હોય, લકડીકા સાચા આહિસ્તા આહિસ્તા કમ હો જાએગા, યહાં તક કે જવાલકા વકત કમસે કમ રેહ જાએગા, ઈસ સાચેકો નાપ હોય. જબ યહ સાચા બઢને લગે તો યે ઈસ બાતકી અલામત-નિશાની હૈ કે જવાલ હો ગયા. ફિર જબ યે સાચા ઈતના બઢ જાએ કે લકડીકે બરાબર હો જાએ તો એક મિસ્લ વકત હો જાએગા.) ઔર તથ તક રેહતા હૈ જબ તક હર ચીજકા સાચા દુગના ન હો જાએ.

૩. અસ્ન : અસ્નકા વકત ઉસ વકત શુરૂ હો જાતા હૈ જબ હર ચીજકા સાચા ઉસકે બરાબર હો જાએ ઔર સૂરજ ગુરુબ હોને તક બાકી રેહતા હૈ.

હનીફી મસ્લકકે મુતાબિક અસ્નકી નમાજ મુઅખ્યર કરકે (યા’ની સાચા દુગના હો જાએ તથ) પઢના અફઝલ હૈ.

કિસી ઉજ્જુરકે બગેર અસ્નકા મગારિબકે કરીબ તક મુઅખ્યર કરના મકરુહ હૈ.

४. મગરિબઃ મગરિબકા વકત સૂરજકે ગુરુબ હોનેસે શુરુ હોકર યા'ની સુખી ગાયબ હોને તક યા'ની સર્ફેદી પેદા હો જાને તક બાકી રેહતા હૈ.

• મગરિબકી નમાજ અવ્યલ વકતમેં પઢના મુસ્તહબ હૈ જબકે બિલા વજહ મુઅખ્યર કરના મકરૂહ હૈ.

५. ઈશા : ઈશાકા વકત શફ્ક ગાયબ હોનેસે શુરુ હો કર તિહાઈ યા આધી રાત તક બાકી રેહતા હૈ. લેકિન મજબૂરી ઔર ઉઝ્ર હો તો તુલૂએ ફજ તક ઈશાકી નમાજ પઢી જા સકતી હૈ. ઈશાકી નમાજ મુઅખ્યર (તાખીર) કરકે પઢના અફઝલ હૈ.

હર નમાજકા વકત દૂસરી નમાજકા વકત શુરુ હોને તક બાકી રેહતા હૈ સિવાય ફજકે જો સૂરજ નિકલને પર ખત્મ હો જાતા હૈ.

### નમાજ કૌનસે અવકાતમેં પઢના મના હૈ :

૧. અષ્ટકી નમાજકે બાદ યણાં તક કે સૂરજ ગુરુબ હો જાએ.

૨. ફજકી નમાજકે બાદ યણાં તક કે સૂરજ તુલૂઅ હો જાએ.

૩. જબ સૂરજ તુલૂઅ હો રહા હો, યણાં તક કે વહ બુલંદ હો જાએ.

૪. નિસ્હુનાધાર (મધ્યાદ્રન, દોપહર) પર સૂરજ હો, ઔર

૫. જબ સૂરજ ગુરુબ હોનેકે લિયે રૂકે યણાં તક કે ગુરુબ હો જાએ.

ઇન અવકાતમેં નમાજ પઢના મકરૂહ હૈ.

કોઈ અગર સૂરજ તુલૂઅ હોનેસે પેહલે નમાજે ફજ ઔર ગુરુબ હોનેસે પેહલે નમાજે અષ્ટકી એક રક્ખાત (રકૂઅ-સિજદાકે સાથ) પા લે તો, ઉસને નમાજ પા લી વો ઉસે પૂરી કર સકતા હૈ.

સુષ્ટુકી અન્ન ઔર ફર્જ નમાજકે દરમિયાન દો સુન્નતોકે સિવા કોઈ નમાજ નહીં.

---

જબ જમાઅત ખડી હો જાએ તો સિવાય ફરજી કોઈ નમાઝ નહીં.  
(મુસ્લિમ, અહમદ, નસાઈ, તિર્મિજી, અબૂ દાઉદ)

મગર ફિક્હે હનફીમાં સુભકી સુન્નતે જમાઅતકે ખડે હોનેકે બાવુજૂદ  
દૂર ફાસલે પર પઢી જા સકતી હૈને, જબ કે જમાઅતકે ખત્મ હોનેકા અંદેશા  
ન હો.

તન્હા નમાઝ પઠનેવાલેકે લિયે તીન ચીજેં જરૂરી હૈને :

- (૧) સબસે પેહલે વહ નીથ્યત કરે કે વહ અલ્લાહકે લિયે નમાઝ પઠ  
રહા હૈ.
- (૨) ઈસ બાતકી નીથ્યત કરે કે વહ કૌનસી નમાઝ પઠ રહા હૈ.
- (૩) કિબ્લેકી તરફ મુંહ કરે.

ઇમામ ભી વહી નીથ્યત કરે જો તન્હા નમાઝ પઠનેવાલા નીથ્યત  
કરતા હૈ.

#### ૧૦. નમાઝ પઠનેકા તરીકા-તરકીબ :

વુગ્ઝુ કર કે પાક કપડે પહન કર પાક જગા પર કિબ્લેકી તરફ મુંહ કરકે  
ખડે હો જાઓ. નમાઝકી નીથ્યત કરકે દોનો હાથ કાનોં તક ઉઠાઓ ઔર

અલ્લાહુ અકબર

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

કેહ કર હાથોંકો નાફકે નીચે બાંધ લેં. સીધા હાથ ઉપર ઔર ઉલ્ટા હાથ  
ઉસકે નીચે રખેં. નમાઝમાં ઈધર-ઉધર ન દેખેં ઔર અદબસે ખડે હો  
જાઓ. ખુદાએ તાઓલાકી તરફ ધ્યાન રખેં, હાથ બાંધ કર સના પછે.

---

સના:

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ  
وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

સુષ્ઠુનકલ્લાહુમ વ બિહારિક વ તબારકસુક વ તઆલા જહુક વ લા  
ઇલાહ ગૈરુક. (જમેઅ તિર્મિઝી - ૨૪૭)

કિર

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ

અઉજુ બિલાહિ મિનશ્શયતાનિરજમ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ○

બિસ્મિલ્લાહિરરહમા નિરહીમ

પહેં ઔર કિર સૂરાએ ફાતિહા પહેં, સૂરાએ ફાતિહા ખત્મ હોને પર  
આહિસ્તાસે આમીન કહેં. સૂરા ફાતિહાકે બાદ કોઈ સૂરા પહેં.

હનકિયાદકા મરસ્લક યહી હૈ કે આહિસ્તાસે આમીન કહી જાય, એક  
રિવાયતમે ઈમામ માલિક રહ. કા ભી યહી કૌલ મન્કૂલ હૈ ઔર ઈમામ  
શાફી રહ. કા ભી યહી કૌલ હૈ. અલબત્તા હદીસસે આહિસ્તા પઢના  
ઔર બુલંદ આવાજસે પઢના દોનોં સાબિત હૈનું, ઈસલિયે યહ હરગિજ  
સહી નહીં હૈ કે ઈસ બુનિયાદ પર ગિરોહબંદી કી જાએ ઔર એક દૂસરેકો  
લાનત-મલામત કી જાએ, જબકે દોનોં બાતે હદીસસે સાબિત હૈનું તો,  
જિસ તરીકેકો અપને ફહમ (સમજ)કે મુતાબિક સુન્નતસે સમજકર ઉસકી  
ઈતિબાઅ કર રહા હો ઉસકી કદર કરની ચાહિયે ન કે તહકીર વ તજલીલ.

سُورَةٌ فِي تِبْيَانِ :

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ ۝ الرَّحْمٰنُ الرَّحِيمُ ۝ مُلِكُ يَوْمٍ  
اللّٰدِينُ ۝ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ۝ إِهْدِنَا الصِّرَاطَ  
الْمُسْتَقِيمَ ۝ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ ۝ غَيْرُ  
الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ۝

અલહમુ લિલ્લાહિ રાખ્યાલ આલમીન, અર્રહમા નિર્ધીમ, માલિકિ  
થોમિદીન. ઈચ્છા-ક નઅભુદુ વ ઈચ્છાક નસ્તઈન. ઈહૃદ નસ્સિસાતલ  
મુસ્તકીમ. સિરાતલલજીના અનુભવ અલૈહિમ જેરિલ મગ્નૂબિ અલૈહિમ  
વલદાત્તીન. (આમીન.)

وَالْعَصْرِ ۝ إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ ۝ إِلَّا الَّذِينَ أَمْنُوا  
وَعَمِلُوا الصِّلْحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ ۝ وَتَوَاصَوْا بِالصَّبَرِ ۝

વલુ અસૂરિ ઈનલ ઈન્સાના લડી ખુલ્લે ઈલલજીના આમનૂ વ  
અમિલુસાલિહાતિ વ તવાસૌ બિલહક્કિ, વ તવાસૌ બિસ્સથ.

سُور: કે ખત્મ હોને પર

અલ્લાહુ અકબર

اللّٰهُ أَكْبَرُ

કેહ કર રુકૂઅકે લિયે ગુકે. રુકૂઅમે દોનો હાથોસે ઘુટનોકો પકડ લેં,  
ઉગલિયાં ફેલા કર રખ્યે ઔર કમસે કમ તીન બાર

سُبْحَانَ رَبِّ الْعَظِيمِ

સુખાન રબ્બિયલ અજીમ

પઢેં, ફિર

سَمِّيَّ اللَّهُ لِمَنْ حَمِدَهُ

સમિઅલ્લાહુ લિમન હમિદહ  
કેહતે હુએ સીધે ખડે હો જાએં, ફિર....

رَبَّنَا لَكَ الْحَمْدُ

પઢેં,

ફિર તકબીર કેહતે હુએ સજદેમાં જાએં. ઔર કમસે કમ તીન બાર.

سُبْحَانَ رَبِّ الْأَعْلَى

પઢેં. ફિર અલ્લાહુ અકબર કેહ કર દૂસરા સજદહ ઈસી તરફ કરોં. ફિર અલ્લાહુ અકબર કહતે હુએ ખડે હો જાએં, ઈસ તરફ એક રક્ખાત હો ગઈ.

અથ દૂસરી રક્ખાત શુરૂ હુઈ. બિસ્મિલ્લાહ પઢકર સૂરા: એ ફાતિહા પઢેં ઔર આમીન કેહ કર કોઈ દૂસરી સૂરા: મિલાએં ઔર પેહલી રક્ખાતકી તરફ રૂકુઅ ઔર દોનોં સજદે કરકે બેઠ જાએં ઔર અતાહિયાત પઢેં.

અતાહિયાત:

أَتَتْحِيَاتٌ إِلَيْهِ وَالصَّلَوَاتُ وَالظَّيَّابَاتُ، أَسْلَامٌ عَلَيْكَ  
 أَيَّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، أَسْلَامٌ عَلَيْنَا وَعَلَى  
 عِبَادِ اللَّهِ الصَّالِحِينَ أَشْهَدُ أَنَّ لِإِلَهٍ إِلَّا اللَّهُ، وَأَشْهَدُ أَنَّ  
 مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ ○

આતહિયાતુ લિલ્લાહિ વસ્ત્રસલવાતુ વતૌયિબાતુ અસ્સલામુ અલયક  
અથુહનબીયુ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અસ્સલામુ અલેના વ અલા  
ઈબાહિલ્લા હિરસાલિહીન. અશ્રૂહુઅલ્લાઈલાહ ઈલ્લાહાહ વ અશ્રૂહુ  
અના મુહમ્મદન અણહુહ વ રસૂલુહ. (જામેઅ તિર્મિજી - ૨૮૬)

હુરુદે ઈબ્રાહિમ

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى أَلِيٍّ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى  
إِبْرَاهِيمَ، وَعَلَى أَلِيٍّ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ  
بَارِكْ عَلَى مُحَمَّدٍ، وَعَلَى أَلِيٍّ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ  
وَعَلَى أَلِيٍّ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ.

અલ્લાહુમ્ સલ્લિ અલા મુહમ્મદિંવ વ અલા આલિ મુહમ્મદિન કમા  
સલ્લયતા અલા ઈબ્રાહિમ વ અલા આલિ ઈબ્રાહિમ ઈન્ક હમીદુમજ્જુદ.

અલ્લાહુમ્મા બારિક અલા મુહમ્મદિંવ વ અલા આલિ મુહમ્મદિન કમા  
બારકત અલા ઈબ્રાહિમ વ અલા આલિ ઈબ્રાહિમ ઈન્ક હમીદુમજ્જુદ.  
(સહીહ બુખારી - ૬૭૫૭)

હુરુદે ઈબ્રાહિમકે બાદ યે હુઆ પણે:

اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبُ  
إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ، وَارْحَمْنِي إِنَّكَ  
أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ.

---

અલ્લાહુમ્મા ઈન્ની જલમતુ નફ્સી જુલમન કસીરો વલા યગ્રિનુજ્રનૂભ  
ઈલ્લા અન્ન ફગ્રિની મગફિરતન મિન ઈન્દિક વર્ષહમની ઈન્કા અન્નલ  
ગજૂર્રહીમ. (મુતાફિક અલયહ અલ બુખારી - ૮૪)

દુઆ પઢનેકે બાદ સલામ ફર લેં, પેહલે સીધી તરફ ફર ઉલ્ટી તરફ.

**السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ**

અસલામુ અલયકુમ વ રહમતુલ્લાહ (જમેઅ તિર્મિઝી - ૨૮૫)

સલામ ફરનેકે બાદ યે દુઆ પઢેઃ

**اللَّهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ تَبَارَكْتَ**

**يَا ذَا الْجَلَالِ وَالإِكْرَامِ**

અલ્લાહુમ અન્નસલામુ વ મિનકસલામુ તખારકત

યા જલજલાવિ વલ ઈકરામ. (સહીએ મુસ્લિમ - ૧૩૩૫)

દો રક્ખાત વાલી નમાજ પૂરી હો ગઈ.

અગર તીન રક્ખાત યા ચાર રક્ખાતવાલી નમાજે પઢની હો તો  
કઅ્યુદેહમેં અતાહિયાતકે બાદ હુરુદશરીફ ન પઢે બલ્કે અલ્લાહુ અક્બર  
કેહ કર ખેડે હો જાઓ. અગર નમાજ વાજિબ યા સુન્નત યા નફ્સ હૈ તો  
આખરી દો રક્ખાતે ભી પેહલી દો રક્ખાતો કી તરફ પઠ લેં., યાની  
ઉનમેં અલ હમુશરીફકે બાદ કોઈ સૂરા: જરૂર પઢે. ઔર અગર ફર્જ  
નમાજ પઢેં તો તીસરી રક્ખાત ઔર ચોથી રક્ખાતમેં અલ હમુશરીફકે  
બાદ કોઈ સૂરા: ન પઢેં.

## સજ્જદાએ સહ્યવકા બધાન :

સહ્યવકા મતલબ હે ભૂલ જાના. નમાજમાં ભૂલેસે કુછ કમી યા જયાદતી હો જાનેસે જો ખરાબી આ જાતી હૈ ઉસકી તલાકી (ભરપાઈ) કે લિયે નમાજકે આખરી કાંચુદેમાં દો સજ્જદે કરના વાજિબ હૈન, હન સજ્જદોનો સજ્જદાએ સહ્યવ કેઠતે હૈન.

## સજ્જદાએ સહ્યવકા તરીકા :

નમાજકે આખરી કાંચુદેમાં ‘આતાહિયાત’ પઢ લેનેકે બાદ દાહની જાનિબ સલામ ફરેં, ઔર ‘અલ્લાહુ અકબર’ કેછ કર સજ્જદેમાં જાઓ, હિત્ભીનાનસે સજ્જદહ કરેં.’ ફિર અલ્લાહુ અકબર કેછ કર સજ્જદેસે ઉઠે, હિત્ભીનાનસે બેઠેં, ઔર ફિર ‘અલ્લાહુ અકબર’ કેછ કર કે સજ્જદેમાં જાઓ. ઔર હિત્ભીનાનસે સજ્જદહ કરેં, ફિર ‘અલ્લાહુ અકબર’ કેછ કર સજ્જદેસે ઉઠેં ઔર કાંચુદેમાં બેઠ જાઓ, ઔર હસે મા’મૂલ ‘આતાહિયાત’, દુર્દશ શરીર ઔર દુઆ પઢકર દોનોં તરફ સલામ ફરેં.

## વહ સૂરતે જિનમાં સજ્જદાએ સહ્યવ વાજિબ હૈ :

૧. નમાજકે વાજિબાતમાંસે કોઈ વાજિબ ભૂલેસે છૂટ જાએ, મસલન સૂર: ફાતિહા પઢના ભૂલ જાએ યા સૂર: ફાતિહાકે બાદ કોઈ સૂર: મિત્લાના ભૂલ જાએ વગેરહ.

૨. કિસી વાજિબકે અદા કરનેમાં કુછ તાખીર (દેર) હો જાએ. ચાહે તાખીર ભૂલેસે હો જાએ યા કુછ સોચનેકી વજહસે, મસલન કોઈ શાખસ સૂર: ફાતિહા પઢનેકે બાદ ખામોશ ખડા રહે ઔર ફિર કુછ વક્ફકે બા’દ કોઈ સૂર: પદે.

૩. કિસી ફરજકે અદા કરનેમાં તાખીર હો જાએ યા કિસી ફરજકો મુકદમ કર દિયા જાએ, મસલન કિર્તિ કરનેકે બાદ રસૂઅ કરનેમાં તાખીર હો જાએ (યહાં તાખીરસે મુરાદ હિતની દેરકા વક્ફા હૈ જિસમાં આદમી એક

---

સજ્રદહ યા એક રૂકૂઆ કર સકે) યા રૂકૂઆસે પેહલે સજ્રદેમને ચલા જાએ.

૪. કિસી ફર્જકો મુકર્રર અદા કર દિયા જાએ, મસલન દો રૂકૂઆ કર લિયે જાએનો.

૫. કિસી વાજિબકી કેફિયત બદલ દી જાએ, મસલન સર્રી નમાજોમને બુલંદ આવાજસે કિર્ભત કર લી જાએ, યા જહરી નમાજોમને આહિસ્તા કિર્ભત કર લી જાએ, મસલન જુહર ઔર અઞ્ચળમને બુલંદ આવાજસે કિર્ભત કર લી, ઔર મગરિબ વ ઈશા યા ફજૂરમને આહિસ્તા કિર્ભત કર લી.

### સજ્રદહએ સહ્યવકે મસાઈલ :

૧. નમાજકે ફરાઈજમનેસે અગર કોઈ ફર્જ કસદન છૂટ જાએ યા સહ્યવન, તો નમાજ ફાસિદ હો જાએગી. ઈસી તરહ અગર કોઈ વાજિબ કસદન છોડ દિયા ગયા તો ભી નમાજ ફાસિદ હો જાએગી ઔર સજ્રદહએ સહ્યવ કર દેનેસે નમાજ સહીહ ન હોણી બલ્કે નમાજ દોબારા પઢની હોણી.

૨. એક વાજિબ છૂટ જાએ યા એકસે જયાદા, બહાર હાલ એક હી મરતબા દો સજ્રદહ કરના કાફી હૈનું, યહાં તક કે અગર નમાજકે સારે વાજિબાત છૂટ જાએનો તથા ભી દો હી સજ્રદહ કાફી હૈનું, દો સે જયાદા સજ્રદહએ સહ્યવ કરના સહી નહીં હૈ.

૩. અગર કોઈ ભૂલેસે હાલતે કયામમને સૂર: ફાતિહાસે પેહલે અતાહિયાત પઠ લે તો સજ્રદહએ સહ્યવ વાજિબ ન હોણા. ઈસાલિયે કે સૂર: ફાતિહાસે પેહલે ખુદાકી હમ્દ વ સના પઢી જાતી હૈ, ઔર અતાહિયાતમને ભી ખુદાકી હમ્દ વ સના હૈ, હાં, અગર કિર્ભતકે બાદ યા દૂસરી રક્ખાતમને કિર્ભતસે પેહલે યા કિર્ભતકે બાદ અતાહિયાત પઠ લી જાએ તો સજ્રદહએ સહ્યવ વાજિબ હોણા.

૪. અગર કિસીસે ભૂલેસે કોમા (રૂકૂઆસે ઉઠનેકે બાદ ઈત્સીનાનસે સીધા ખડે હોનેકો કોમા કહતે હૈનું, કોમા નમાજકે વાજિબાતમનેસે હૈ) કરના

---

રેઠ જાએ યા દોનોં સજ્ઞાઓકે દરમ્યાન જલસા (સજ્ઞાઓકે દરમ્યાનકી નશિસ્ત-  
બેઠનેકો ફિકછકી ઈસ્ટિલાહમેં જલસા કણ જાતા હૈ, જલસા નમાઝકે  
વાજિબાતમેંસે હૈ, રેઠ જાએ તો સજ્ઞાએ સહ્યવ કરના જરૂરી હૈ.

૫. અગર કોઈ શખ્સ કાસ્યુદાએ ઊલા કરના ભૂલ ગયા ઔર બેઠનેકે  
બજાએ ઉઠકર પૂરી તરફ ખડા હો ગયા તો ફિર યાદ આને પર ન બેઠે  
બલ્કે નમાઝ પૂરી કરકે કાયદેકે મુતાબિક સજ્ઞાએ સહ્યવ કરે, ઔર અગર  
પૂરી તરફ ખડા ન હુવા હો બલ્કે સજ્ઞાદેસે કરીબ હો તો બેઠ જાએ ઔર ઈસ  
સૂરતમેં સજ્ઞાએ સહ્યવ કરનેકી જરૂરત નહીં.

૬. અગર કોઈ શખ્સ કાસ્યુદાએ ઊલા કરના ભૂલ ગયા ઔર બેઠનેકે  
બજાએ ઉઠકર પૂરી તરફ ખડા હો ગયા તો ફિર યાદ આને પર ન બેઠે  
બલ્કે નમાઝ પૂરી કર કે કાયદે કે મુતાબિક સજ્ઞાએ સહ્યવ કરે, ઔર અગર  
પૂરી તરફ ખડા ન હુવા હો બલ્કે સજ્ઞાદેસે કરીબ હો તો બેઠ જાએ ઔર ઈસ  
સૂરતમેં, સજ્ઞાએ સહ્યવ કરને કી જરૂરત નહીં.

૭. અગર કોઈ દો યા ચાર રક્ખાતવાળી ફર્જ નમાઝમેં કાસ્યુદાએ અખીરા  
ભૂલ ગયા ઔર બેઠનેકે બજાએ ઉઠ કર ખડા હો ગયા, અથ અગર ઉસકો  
સજ્ઞાદા કરનેસે પેહલે યાદ આ જાએ તો બેઠ કર નમાઝ પૂરી કરે ઔર  
સજ્ઞાએ સહ્યવ કર લે. સજ્ઞાએ સહ્યવ કર લેનેકે બાદ ફર્જ નમાઝ દુરુસ્ત  
હો જાએગી, ઔર અગર સજ્ઞાદા કર લેનેકે બાદ યાદ આયા કે કાસ્યુદાએ  
અખીરા નહીં તિયા હૈ તો અથ ન બેઠે. બલ્કે એક રક્ખાત ઔર મિલાકર  
ચાર રક્ખાત યા છ રક્ખાત પૂરી કરે. ઔર ઈસ સૂરતમેં સજ્ઞાએ સહ્યવ  
કરનેકી જરૂરત નહીં હૈ. ઔર યે જાઈદ રક્ખાતેં નફ્ફલ કરાર પાંચેગી,  
ફર્જ નમાઝ દોબારા અદા કરની હોગી. ઔર અગર મગરિબકે ફર્જમેં  
ભૂલ હો જાએ તો ફિર પાંચવી રક્ખાત ન પઢેં, ચોથી રક્ખાતમેં બેઠ કર  
નમાઝ પૂરી કર લે, ઈસ લિયે કે નફ્ફલકી રક્ખાતેં તાક-એકી નહીં હોતી,  
આપ સલ્લાહ્વાહુ અદૈહિ વસલ્લામકા ઈશાર્દિ હૈ, ‘નફ્ફલ નમાઝકી રક્ખાતેં  
દો દો હેં.’

૮. અગર સૂરઃ ફાતિહા પઢના ભૂલ જાએ, યા દુઆએ કુનૂત પઢના ભૂલ જાએ, યા ‘અત્તહિયાત’ પઢના ભૂલ જાએ, યા ઈદુલફિત્ર યા ઈદુલ અઝાકી આઈદ તકબીરે ભૂલ જાએ તો સજૂદાએ સહ્લવ કરના વાજિબ હૈ.

૯. મગારિબ, ઈશા યા ફજકી જહરી (જહરી વો નમાઝ હૈ જિસમે ઈમામકે લિયે બુલંદ આવાજસે કિર્ખત કરના વાજિબ હૈ, મસલન મગારિબ ઔર ઈશાકી પેહલી દો રક્ખાતેં ઔર ફજ, જુમ્મા ઔર ઈટેનકી નમાઝે જરૂરી હૈ, ઈસ લિયે કે ઈનમે બુલંદ આવાજસે કિર્ખત કરના ઈમામકે લિયે વાજિબ હૈ.) નમાઝોમેં અગર ઈમામને ભૂલેસે કિર્ખત આહિસ્તા કી યા જુહર ઔર અષ્ટકી સર્રી નમાઝોમેં (જિન નમાઝોમેં ઈમામકે લિયે ખામોશીસે કિર્ખત કરના વાજિબ હૈ ઉન નમાઝોકો સર્રી નમાઝ કેછતે હૈન, મસલન જુહર ઔર અષ્ટકી નમાઝ) ઈમામને ભૂલેસે કિર્ખત બુલંદ આવાજસે કી તો સજૂદાએ સહ્લવ કરના વાજિબ હૈ.

૧૦. અગર ઈમામસે કોઈ વાજિબ વગૈરહ છૂટ જાએ ઔર સજૂદાએ સહ્લવ વાજિબ હો જાએ તો મુક્તદીકો ભી સજૂદાએ સહ્લવ કરના હોણા. ઔર અગર મુક્તદીસે કોઈ વાજિબ વગૈરહ છૂટ જાએ તો ન મુક્તદી પર સજૂદાએ સહ્લવ વાજિબ હોણા ઓર ન ઈમામ પર.

૧૧. અગર સૂરઃ ફાતિહાકે બાદ દૂસરી સૂરઃ મિલાના ભૂલ જાએ, યા સૂરઃ પેહલે પઢ લે, ઔર સૂરઃ ફાતિહા બા'દમે પઢે તો સૂરઃ ફાતિહાકે બાદ ફિર કોઈ સૂરઃ પઢે ઔર આખરી કાંદુદેમે લાજિમન સજૂદાએ સહ્લવ કરે.

૧૨. અગર ફર્જ નમાઝકી પેહલી દો રક્ખાતોમેં યા એક રક્ખાતમેં સૂરઃ મિલાના ભૂલ જાએ તો બા'દકી રક્ખાતોમેં સૂરઃ મિલા લે ઓર સજૂદાએ સહ્લવ કરકે નમાઝ પૂરી કરે.

૧૩. અગર સુન્નત યા નફ્લ નમાઝકી કિસી રક્ખાતમેં સૂરઃ મિલાના ભૂલ જાએ તો સજૂદાએ સહ્લવ કરના લાજિમ હૈ.

૧૪. અગર કોઈ ચાર રક્ખાતવાલી ફર્જ નમાઝકી આખરી રક્ખાતમે ઈતની દેર તક બેઠા જિતની દેરમે 'અતાહિયાત' પઢી જાતી હો, ઔર ફિર ઉસે શુભ હુવા કે યે કાજૂદાએ ઊલા હૈ ઔર વહ સલામ ફરનેકે બજાએ પાંચવી રક્ખાતકે લિયે ઉઠ ખડા હુવા, અથ સજદા કરનેસે પેહલે ઉસે યાદ આ જાએ તો બેઠ કર નમાઝ પૂરી કરે ઔર હસ્બે કાયદા સજૂદાએ સહૃદવ ભી કર લે. (ઇસ લિયે કે સલામ ફરનેમે તાખીર હો ગઈ) ઔર સલામ ફર લે ઔર અગર પાંચવી રક્ખાતકા સજદા કર લિયા હૈ તો છાંટી રક્ખાત ઓર મિલા લે ઔર સજૂદાએ સહૃદવ કરકે નમાઝ પૂરી કર લે, ઇસ સૂરતમે ઉસકી ફર્જ નમાઝ સહી હો જાએગી ઔર યહ દો જાઈદ રક્ખાતોં નફ્ફલ કરાર પાંચેંગી.

૧૫. ચાર રક્ખાતવાલી ફર્જ નમાઝકી આખરી દો રક્ખાતોમાં કોઈ મુન્હરિદ યા ઈમામ સૂરઃ ફાતિહા પઢના ભૂલ જાએ તો સજૂદાએ સહૃદવ વાજિબ ન હોગા, હાં અગર સુન્નત યા નફ્ફલ નમાઝોમાં ભૂલ જાએ તો સજૂદાએ સહૃદવ વાજિબ હૈ. ઇસ લિયે કે ફર્જ નમાઝકી આખરી રક્ખાતોમાં સૂરઃ ફાતિહા પઢના વાજિબ નહીં હૈ, ઔર સુન્નત ઔર નફ્ફલ નમાઝકી હર રક્ખાતમે સૂરઃ ફાતિહા પઢના વાજિબ હૈ.

૧૬. અગર કોઈ ભૂલસે એક રક્ખાતમે દો રૂક્ખાસ કર લે, યા એક રક્ખાતમે તીન સજૂદે કર લે, યા સૂરઃ ફાતિહા દો બારા પઢ લે તો સજૂદાએ સહૃદવ વાજિબ હો જાએગા. (ઇસ લિયે કે સૂરઃ ફાતિહાકા એક બાર પઢના વાજિબ હૈ).

૧૭. અગર કાજૂદાએ ઊલામે અતાહિયાત પઢનેકે બાદ કોઈ દુરુદ શરીરક પઢને લગે ઔર અલ્લાહુમ્મ સાલ્લિઅલા મુહમ્માનિનકે બક્ર (જિતના) પઢ લે યા ઈતની દેર યું હી ખામોશ બેઠા રહે તો સજૂદાએ સહૃદવ વાજિબ હો જાએગા.

૧૮. અગર કિસી મસ્ખૂકસે (મસ્ખૂક ઉસ મુકતદીકો કેહતે હો જો કુછ તાખીરસે જમાઅતમે આકર શરીક હો જબ કે એક યા એક સે જાઈદ

---

રક્ખાતેં હો ચુકી હોં) અપની બાકી નમાજ પૂરી કરનેમેં કોઈ કોતાહી હો જાએ તો નમાજકે આખરી કઅદેમેં ઉસ પર સજ્જદાએ સહૃવ કરના વાજિબ હૈ.

૧૯. અગર કિસીને ઝુહર યા અસ્તકી ફર્જ નમાજકી હો રક્ખાતેં પઢી, લેકિન યે સમજ કર કે ચારોં રક્ખાતેં પઠ ચુકા હૈ, ઉસને સલામ ફર લિયા, ઔર સલામ ફરનેકે બાદ યાદ આયા કે હો હી રક્ખાતેં પઢી હૈને તો બાકી હો રક્ખાતેં પઠ કર નમાજ પૂરી કર લે ઔર સજ્જદાએ સહૃવ કરે.

૨૦. અગર કિસીકો નમાજમેં શક હો ગયા કે મા'લૂમ નહીં તીન રક્ખાતેં પઢી હૈને યા ચાર તો અગર ઉસકો ઈતિફાકસે પેહલી બાર યે શક હુવા હૈ, આમ તૌર પર ઉસકો ઈસ તરહકે શક કરનેકી આદત નહીં હૈ, તો ઉસકો હો બારા નમાજ પઢની ચાહિયે ઔર અગર ઉસકો અકસર વ બેશતર ઈસ તરહકા શક હોતા હી રેહતા હૈ તો ફિર વહ અપને ગુમાને ગાલિબ (ઐસા શુભ્ષ-ગુમાન- જો યકીન કે દર્જે કા હો) પર અમલ કરે, ઔર અગર કિસી તરફ જ્યાદા ગુમાન ન હો તો ફિર કમ રક્ખાતોમેં એ'તેબાર કરે, મસલન કિસીકો ઝુહરકી નમાજમેં શક હો જાએ કે મા'લૂમ નહીં તીન રક્ખાતેં હુઈ હૈને યા ચાર, ઔર કિસી તરફ ગુમાને ગાલિબ ભી નહીં હૈ, તો ઉસ સૂરતમેં યહી સમજે કે તીન હી રક્ખાતેં પઢી હૈને, ઔર એક રક્ખાત ઔર પઠ કર ચાર રક્ખાત પૂરી કરે, ઔર સજ્જદાએ સહૃવ હર સૂરતમેં કરે.

૨૧. નમાજકી સુન્નતેં યા મુસ્તાહિબાત છૂટ જાનેસે સજ્જદાએ સહૃવ વાજિબ નહીં હોતા, મસલન નમાજકે શુરુમેં સના પઢના ભૂલ ગયા, યા રકૂઅ ઔર સજ્જદેમેં તસ્બીહ પઢના ભૂલ જાએ, યા રકૂઅમેં જાને ઔર ઉઠનેકી દુઓ ભૂલ જાએ યા દુર્દાશ શરીફ ઔર ઉસકે બાદકી દુઓ ભૂલ જાએ તો ઈન તમામ સૂરતોમેં સજ્જદાએ સહૃવ વાજિબ ન હોગા.

૨૨. નમાજમેં કોઈ ઐસી કોતાહી હો ગઈ જિસકી વજહસે સજ્જદાએ સહૃવ લાજિમ હો ગયા હૈ, લેકિન ઉસને નમાજ પૂરી કર લી ઔર સજ્જદાએ

સહ્યવ કરના ભી ભૂલ ગયા, સલામ ફેરનેકે બાદ યાદ આયા કે સજ્જદએ સહ્યવ રહ ગયા, અથ અગર ઉસને કિબલેકી તરફસે રૂખ નહીં ફેરા હૈ, ઔર કિસીસે બાતચીત ભી નહીં કી હૈ, તો ફૌરન સજ્જદએ સહ્યવ કર લે, ઔર ફિર અત્તાહિયાત, દુરુદ ઔર દુઆ પઢ કર સલામ ફેર દે.

૨૩. અગર કિસીને એક રક્ખાતમેં ભૂલસે એક હી સજ્જદા કિયા, અથ અગર ‘કાયુદએ આખીરા’કી ‘અત્તાહિયાત’ પઢનેસે પેહલે પેહલી રક્ખાતમેં યા દૂસરી રક્ખાતમેં યા જબ ભી યાદ આઓ તો સજ્જદા અદા કર લે. ઔર હરબે કાયદા સજ્જદએ સહ્યવ કરે ઔર અગર ‘અત્તાહિયાત’ પઠ લેનેકે બાદ સજ્જદા યાદ આયા તો સજ્જદએ સહ્યવ અદા કરનેકે બાદ ‘અત્તાહિયાત’ ફિર પઢે ઔર સજ્જદએ સહ્યવ કરકે હરબે કાઈદા નમાજ પૂરી કરે.

૨૪. અગર સફરકે દૌરાન જબ કે કષ્ટકા પઢના વાજિબ હૈ કિસીને ભૂલસે કષ્ટ કરનેકે બજાએ પૂરી ચાર રક્ખાત નમાજ પઢી, ઔર દૂસરી રક્ખાતમેં બેઠ કર ‘અત્તાહિયાત’ પઠ લી, તો ઈસ સૂરતમેં ભી આખરી રક્ખાતમેં કાઈદેકે મુતાબિક સજ્જદએ સહ્યવ કરના વાજિબ હૈ, ઔર ઈસ સૂરતમેં યે નમાજે કષ્ટ ઈસ તરફ સહી હો જાએગી કે પેહલી દો રક્ખાત ફર્જ કરાર પાએંગી ઔર આખરી દો રક્ખાતેં નફૂલ કરાર પાએંગી.

### વિત્રકી નમાજ :

વિત્રકી નમાજ વાજિબ હૈ. ઈસકી તીન રક્ખાતોં હેં ઔર ઈશાકી ફર્જ નમાજકે બાદ પઢી જાતી હૈ, અગર કિસી વજહસે વિત્રકી નમાજ છૂટ જાઓ તો ઉસકી કઝ વાજિબ હૈ ઔર બિલા ઊઝૂર છોડના સત્ત ગુનાહ હૈ. ઈસકી તીસરી રક્ખાતમેં દુઆએ કુનૂત પઢી જાતી હૈ.

---

હુએએ કુનૂત :

اَللّٰهُمَّ اِنّا نَسْتَعِينُكَ وَنَسْتَغْفِرُكَ وَنُؤْمِنُ بِكَ وَنَتَوَكّلُ  
عَلَيْكَ وَنُثْنِي عَلَيْكَ الْخَيْرَ وَنَشْكُرُكَ وَلَا نَكْفُرُكَ  
وَنَخْلُعُ وَنَتَرُكُ مَنْ يَفْجُرُكَ اَللّٰهُمَّ اِيَّاكَ نَعْبُدُ وَلَكَ  
نُصَلِّي وَنُسَجُّدُ وَإِلَيْكَ نُسْعَى وَنَحْفِدُ وَنَرْجُو رَحْمَتَكَ  
وَنَخْشِي عَذَابَكَ اِنَّ عَذَابَكَ إِلَى الْكُفَّارِ مُلْحِقٌ.

અલ્લાહુમ્મા ઈન્ નસ્તરીનુક વ નસ્તગ્રાહિકુક વ નુઅ મિનુ બિક વ ન  
તવક્કલુ અલૈક વ નુસ્ની અલૈકલ ઐર વ નશુકુરુક વ લા નકુરુરુક વ નખુલઉ  
વ નતરુકુ મૈચ્છદજુરુ ક અલ્લાહુમ્મ ઈયા ક ના'બુદુ વ લ ક નુસલ્લી વ  
નસજુદુ વ ઈલે ક નસ્સા વ નદ્ધિદુ વ નજૂર રધમત ક વ નષા અગાબ ક  
ઈન અગાબ ક બિલ કુફ્ફારિ મુલ્હિક. (સુનાન બયહડી બાબ હુએએ  
કુનૂત - ૨૨૩)

### નમાજે તરાવીહ :

નમાજે તરાવીહ ઔરત ઔર મદ્દ દોનોકે લિયે સુન્તતે મુઅક્કિદા હૈ  
ઔર જમાઅતસે પઢના સુન્તત હૈ, યા'ની અગર મુહલ્લેકી મસ્નિદમેં  
નમાજે તરાવીહ જમાઅતસે પઢી જતી હૈ ઔર કોઈ ઈન્સાન કિસી વજહસે  
તન્હા ઘરમેં પઢ લો તો ગુનેહગાર નહીં હોગા.

નમાજે તરાવીહકા વકત ઈશાકી ફર્જ નમાજ પઢનેકે બા'દસે ફજ તક  
હૈ. તરાવીહમેં બીસ રક્ખાતે હોય.

## બીમારી નમાજકા બયાન :

અગર મરીજમેં ખડે હોનેકી તાકત ન હો યા ખડે હોનેસે સખ્ત તકલીફ પહોંચતી હો, યા બીમારી જ્યાદા હો જાનેકા ખતરા હો, યા સરમેં ચક્કર આનેસે ગિર જાનેકા ઊર હો. તો નમાજ બેઠ કર પંઢ સકતા હૈ. રુકૂઅ ઔર સજ્ઞા કરનેકી તાકત નહીં હૈ તો સરકે ઈશારેસે નમાજ પઢે.

## મુસાફિરકી નમાજકા બયાન :

શરીરાતમેં મુસાફિર ઉસકો કેહતે હૈ જો ઈતની દૂર જાનેકા ઈરાદા કરકે નિકલે જહાં તીન દિનમાં (ચલ કર) દરમિયાની ચાલસે પહોંચ સકે. દરમિયાની દર્જેકી ચાલસે પૈદલ આદમીકી ચાલ મુરાદ હૈ ઔર ઠીક બાત તો યહ હૈ કે તીન મંજિલકી મુસાફરી મોઅતબર હૈ ઔર આસાનીકે લિયે અડતાલીસ મીલકી મુસાફરી તીન મંજિલકે બરાબર સમજ લી ગઈ હૈ.

જો શાખ્સ કિસી તેજ રફતાર ગાડી જૈસે કે હવાઈ જહાઝ, રેલગાડી, મોટર વહેરહમેં ૪૮ મીલ બહુત હી જલ્દી પહોંચ જાએ વહ ભી મુસાફિર સમજા જાએગા. મુસાફિર જુહર, અસ્ત ઔર ઈશાકી નમાજેં બજાએ ચાર રફતકે દો રફતકે પઢે (ઉસે શરીરાતમેં કષ્ટ (છોટા કરના) કેહતે હૈને.

જબ મુસાફિર અપની બસ્તીસે બાહર આ જાએ ઉસ વકતસે કષ્ટ કરને લગે. મુસાફિર ઉસ વકત તક કષ્ટ કરતા રહે, જબ તક વો સફર કરે ઔર અગર કિસી જગા હુએ હો, જૈસે કે દસ-બારહ દિન તો ભી કષ્ટ કરે, અગર કિસી જગા દસ-બારહ દિન ઠહરનેકી નીથ્યત કી લેક્ન કામ પૂરા ન હુઅા ઔર ફિર પાંચ-છ દિન ઠહરનેકી નીથ્યત કર લે તો વો ભી કષ્ટ કરેગા. મુસાફિર કિસી મુકીમ ઈમામકે પીછે નમાજ પઢે તો મુસાફિરકો ભી પૂરી રફતાં પઢના ફર્જ હૈને.

કષ્ટ સિર્જ ફર્જ નમાજોમાં હૈ, સુન્નત ઔર નફ્લમાં નહીં હૈ. બસ, મોટરકાર, રેલગાડી ઔર હવાઈ જહાઝમાં નમાજ પઢના જાઈજ હૈ. અગર

---

ખડે હો કર પઢનેકી જગા હો તો ખડે હોકર પહે વરના બેઠ કર પહે.

## જુમ્બાકી નમાજકા બ્યાન:

ઈસ્લામમાં જુમ્બાકી નમાજકી બહોત જ્યાદા એહમિયત હૈ ઔર જુહરકી નમાજસે ભી જ્યાદા ઈસકી તાકીદ હૈ. જુમ્બાકે દિન જુહરકી નમાજ નહીં હૈ, જુમ્બાકી નમાજ ઉસકે કાયમ્બ્રમુકામ કર દી ગઈ હૈ.

જુમ્બાકી નમાજ આજાદ, બાલિગ, સમજદાર, તંહુરસ્ત ઔર મુંકીમ મર્દોं પર ફર્જ હૈ. ઈસ લિયે નાબાલિગ બચ્ચોં, ગુલામોં, દીવાનોં, બીમારોં, અંધોં, અપાછિઓં, મુસાફિરોં ઔર ઔરતોં પર ફર્જ નહીં હૈ. અગર મુસાફિર, અંધે, અપાછિજ, બીમાર ઔર ઔરતોં જુમ્બામાં શરીક હો જાએં તો ઉનકે જિમ્મેસે જુહરકી નમાજ સાકિત હો જાએગી ઔર જુમ્બાકી નમાજ દુસ્સુત હો જાએગી.

## જુમ્બાકી નમાજકી શરતો:

જુમ્બાકી નમાજ ઠીક ઔર સહી હોનેકે લિયે પાંચ શરતો હોય :

- (૧) શહર, બડા ગાંવ ઔર કસબેકા હોના. છોટે છોટે દેહાતોમાં જુમ્બા દુસ્સુત નહીં.
- (૨) જુહરકા વકત હોના.
- (૩) નમાજસે પેહલે ખુત્બા પઢના.
- (૪) જમાઅતસે નમાજ પઢના.
- (૫) ઈજને આમ યા'ની હર મુસલમાનકો નમાજ પઢનેકી આમ ઈજાત હો.

ખુત્બા અરબી જબાનમાં હૈ. બહેતર યહ હૈ કે પેહલા ખુત્બા ઉર્દૂ જબાનમાં હો ઔર ખુત્બાએ સાની (દૂસરા) અરબીમાં હો.

ખુલ્બેકે વકત બાર્તે કરના, સુન્નત યા નફ્ફલ નમાજ શુરુ કરના, ખાના-  
પીના, કિસી બાતકા જવાબ દેના, કુર્અન્ડી તિલાવત કરના, ગર્જ ધહ કે  
તમામ કામ જો ખુલ્બા સુનનેમેં ખલલ ડાલેં મકરૂહ હું. અલભતા દૌરાને  
ખુલ્બા કાં નમાજ પઢના ન સિર્જ જાઈ બલ્કે વાજિબ હૈ. જુમ્માકી  
નમાજમેં ઈમામકે અલાવા કમસે કમ તીન આદમી હોના જરૂરી હું,  
અગર તીન આદમી ન હોંગે તો જુમ્માકી નમાજ સહીહ ન હોગી. જુમ્માકી  
ફર્જ નમાજમેં દો રક્ખાતેં હું.

### ઈદેનકી નમાજ :

ઈદુલફિલ ઔર ઈદુલઅઝાહી નમાજોંકો ઈદેનકી નમાજ કેહતે હું,  
દોનોં ઈદોંકી નમાજેં વાજિબ હું, ઔર જિન લોગોં પર જુમ્માકી નમાજ  
ફર્જ હથ ઉન્હીં પર ઈદેનકી નમાજેં ભી વાજિબ હું, ઔર જો શર્તો જુમ્માકી  
નમાજકી હું વહી શર્તો ઈદેનકી નમાજોંકી ભી હું. મગર ઈદેનકી નમાજકા  
ખુલ્બા તો ફર્જ હૈ ઔર નમાજસે પેહલે યા નમાજકે બાદ ખુલ્બા પઢના  
સુન્નત હૈ.

ઈદેનકી નમાજસે પેહલે ગુસ્લ ઔર મિસ્વાક કરના, અપને લિબાસમેંસે  
અચ્છા લિબાસ પહનના, ખુશ્ભૂ લગાના, ઈદગાહમેં જાનેસે પેહલે ખજૂરેં  
યા કોઈ મીઠી ચીજ ખાના, સદ્કએ ફિલ અદા કરકે જાના.

ઈદુલ અઝાહમેં નમાજકે બાદ આકર અપની કુબાનીકા ગોશ્ટ ખાના.

ઈદગાહમેં ઈદકી નમાજ પઢના, પૈદલ જાના, એક રાસ્તેસે જાના ઔર  
દૂસરે રાસ્તેસે આના, ઈદકી નમાજસે પેહલે ઘરમેં યા ઈદગાહમેં નફ્ફલ  
નમાજ ન પઢના ઔર ઈદકી નમાજકે બાદ ઈદગાહમેં નફ્ફલ ન પઢના.

ઈદુલફિલમેં આહિસ્તા આહિસ્તા તકબીર કેહતે હુએ જાએ ઔર ઈદુલ-  
અઝાહમેં જોર-જોરસે તકબીર કેહતે હુએ જાના મુસ્તહબ હૈ.

## જનાર્જેકી નમાજકા બધાન :

જનાર્જેકી નમાજ ફર્જ કિફાયા હૈ યા'ની અગર મોહલ્લેકે એક-દો આદમી ભી પઢ લેં તો સબકે જિમ્મેસે ફર્જ સાકિત હો જાએગા ઔર કિસીને ભી ન પઢી તો સબ ગુણ્ણાગાર હોંગે.

## જનાર્જેકી નમાજકી શરતેં :

- (૧) મૈયતકા મુસલમાન હોના.
- (૨) મૈયતકા પાક હોના.
- (૩) સત્રરકા ઢકા હોના.
- (૪) મૈયતકા નમાજ પઢનેવાલેકે સામને રખા હુવા હોના.

યે શર્તોં તો મૈયતકે મુતાલ્લિક થીં, નમાજિયોંકે લિયે વહી શર્તોં હૈને જો નમાજકી શરાઈતમેં બધાન કી ગઈ હૈને.

## નમાજે જનાર્જાકી તરકીબ યે હૈ :

પેહલે નમાજકે લિયે સફ્ફ બાંધ કર ખડે હોં. અગર આદમી જયાદા હોં તો તીન, પાંચ યા સાત સફ્ફ બનાના બહેતર હૈ, જબ સફ્ફ દુરુસ્ત હો જાએં તો ઈસ તરફ નમાજકી નીઘત કરેં :

“મેં ખુદાકે લિયે ઈસ જનાર્જેકી નમાજ ઈસ ઈમામકે પીછે પઢતા હું.”

ફિર ઈમામ જોરસે ઔર મુકતદી આહિસ્તાસે તકબીર કહેં ઔર હાથ કાનોં તક ઉઠા કર નાફસે નીચે બાંધ લેં ઔર ઈમામ વ મુકતદી આહિસ્તા આહિસ્તા સના પઢેં, ફિર ઈમામ જોરસે ઔર મુકતદી આહિસ્તા બગૈર હાથ ઉઠાએ તકબીર કહેં ઔર દોનોં દુરુદ જો નમાજકે કાંઈદાર અખીરહમેં પઢી જાતી હોં, ઈમામ ઔર મુકતદી આહિસ્તા આહિસ્તા પઢેં. ફિર દૂસરી તકબીરકી તરફ તીસરી તકબીર કહેં ઔર ઈમામ વ મુકતદી આહિસ્તા આહિસ્તા યે દુઆમેં પઢેં:

---

બાળિગ મર્દ ઓર ઔરત કે લિયે :

اللَّهُمَّ اغْفِرْ لِعَيْنَا وَمَيْتَنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا  
وَكَبِيرِنَا وَذَكِيرِنَا وَأُنْشَانَا، اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنْ نَّا فَاحْيِه  
عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنْ نَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ.

અલ્લાહુમ્માફિર લિહેયિના વ મૈયિતિના વ શાહિદિના વ ગાઈબિના વ  
સગીરિના વ કબીરિના વ જકરિના વ ઉન્સાના, અલ્લાહુમ્મ મન અહૃયયતહુ  
મિના ફ અહૃયિહે અલલ ઈસ્લામ, વ મન તવફકૈતહુ મિના ફ ત વફકૈતહુ  
અલલ ઈમાન. (જમેઅ તિર્મિજી - ૧૦૨૪)

લડકેકે લિયે :

اللَّهُمَّ اجْعَلْهُ لَنَا فَرَّطاً وَاجْعَلْهُ لَنَا أَجْرًا وَذُخْرًا  
وَاجْعَلْهُ لَنَا شَافِعاً وَمُشْفَعاً

અલ્લાહુમજ અલહુ લના ફ ૨ તો વજ અલહુ લના અજરોવ જુખરોવ વજ  
અલહુ લના શાફિઓ વ મુશ્ફુફા.

---

લડકીકે લિયે :

اَللّٰهُمَّ اجْعَلْهَا لَنَا فَرِطاً وَاجْعَلْهَا لَنَا أَجْرًا وَذُخْرًا  
وَاجْعَلْهَا لَنَا شَافِعَةً وَمُشْفَعَةً

અલ્લાહુમ્જઅલહા લના ફરતો વજુઅલ્લાહા લના અજરોવ જુખરો  
વજુઅલહા લના શાફિઓ વ મુશર્ફતવક્ફહુ અલલ ઈમાન.

ઈસકે બાદ ઈમામ ઝોરસે ઔર મુકતદી આહિસ્તાસે ચોથી તકબીર  
કહે. ફિર ઈમામ ઝોરસે ઔર મુકતદી આહિસ્તાસે પેહલે દાંઈ તરફ ઔર  
ફિર બાંઈ તરફ સલામ ફેર દેં. નમાજસે ફારિગ હોતે હી જનાજેકો ઉઠા  
કર લે ચલેં.

ચલતે વકત કલમા શરીફ વગેરહ તો દિલમેં પઢે, આવાજસે પઢના  
મકરૂહ હૈ. કષ્ટ ઔર હિસાબ-કિતાબ ઔર દુનિયાકી બેભે, તેબારીકા  
ધ્યાન કરેં. દિલમેં મૈયતકે લિયે મગફિરત ઔર આસાનીકે લિયે દુઆ  
કરતે રહેં ઔર કષ્ટસ્તાન પહોંચકર મૈયતકો દફન કર દેં.

---

# ૪. મરનૂન દુઆએ

## દુઆ ઓર ઉસકી અહિમયત :

ઈસ્લામમાં દુઆકી બડી એહિમયત હૈ. હજરત મુહમ્મદ સ.અ.વ.ને દુઆકો ઈબાદત ફરમાયા હૈ, બલ્કે એક જગત તો દુઆકો ઈબાદતકા મગૂજ બતાયા હૈ.

હજરત મુહમ્મદ સ.અ.વ.કા ઈશર્છા યહ હૈ કે જિસે અલ્લાહ તથાલા દુઆ માંગનેકી તૌફીક દેતા હૈ ઉસકે લિયે રહમતકે દરવાજે ખુલ જાતે હોય ઔર ‘દુઆ મો’મિનકા હથિયાર હૈ, દીનકા સુતૂન હૈ ઔર આસમાન વ જમીનકી રોશાની હૈ.’ (હાકિમ)

## દુઆકે અલફાઝ :

સબસે બેહતર ઔર અચ્છા તરીકા તો યહ હૈ કે દુઆકે લિયે વહ અલફાઝ ઈસ્ટોમાલ કિયે જાઓ જો કુઅનેપાક યા હદ્દીસોમાં આએ હોય લેકિન દુઆકે લિયે કિસી જબાનકી કેદ નહીં હૈ. બંધા અપને આકાસે જિસ જબાનમાં ચાહે દુઆ માંગ સકતા હૈ. કુર્અની દુઆઓં ઔર મસનૂન દુઆઓંકા મતલબ ભી યાદ કર લો ઔર દુઆ માંગતે વકત ઉનકે મતાલિબ (મા'ની)કો અપને જહનમાં રખ્યો.

## દુઆકે આદાબ :

દુઆકે લિયે કુછ ઝરૂરી આદાબ હોય, ઉનસે અગાર ગફલત બરતી જાએગી તો દુઆઓંસે કોઈ ફાયદા હાસિલ નહીં હોગા.

(૧) દુઆકે લિયે પેહલી ઔર ઈન્ટોહાઈ ઝરૂરી શર્ત યહ હૈ કે બંદેકી પૂરી લિંગાંગી અલ્લાહકી ઈતાઅત ઔર ઉસકે રસૂલકી ફરમાંબરદારીકે લિયે વફક્ષ હો, દૂસરોંકી વફાદારી ઔર ઈતાઅત ઔર ગુલામીકા ફંદા અપની ગર્દનમાં ન ડાલ રખ્યા હો.

(૨) અપની રોગીમાં હલાલ વ હરામ ઔર જાઈજ ઔર નાજાઈજકા પૂરા પૂરા ખયાલ રખ્યા હો.

(૩) દુઆ સિર્ફ ખુદાસે માંગી જાએ ઔર ઉસકે સિવા કિસીકો ભી અપની હાજરત પૂરી કરનેકે લિયે ન પુકારેં.

- (૪) ખુદાસે જો કુછ માંગો હલાલ ઔર પાક હો, નાજાઈજ મકસદ ઔર ગુનાહકે કામોકે લિયે ખુદાસે હરગિઝ દુઆ ન કરે.
- (૫) અલ્લાહ પર પૂરે યકીન ઔર કામિલ ભરોસેકે સાથ દુઆ માંગો કે વહ હમારી હર ફરિયાદકો સુનતા હૈ ઔર હમ પર મહેરબાન હૈ.
- (૬) દુઆઓકો હર કિસ્મકે શિર્કસે પાક રખ્યે ઓર દુઆઓમં કિસી કિસ્મકી રિયાકારી ઔર દિખાવા ભી ન હો.
- (૭) દુઆ આહિસ્તા આહિસ્તા ઔર ગિડગિડાકર માંગો. ઈસમે ભી દિખાવા ન હો બલ્કે દુઆમેં આજિજી સિર્ફ અલ્લાહકે લિયે હો.
- (૮) દુઆ કરનસે પેહલે કોઈ નેક અમલ જરૂર કરે.
- (૯) જબ ભી મોકા મિલે હર વકત ખુદાકે હુઝૂરમેં દુઆ કરતે રહેં, ઈસલિયે કે મો'મિનકી શાન હી યહ હૈ કે વહ દુઃખ ઔર ખુશીમેં, તંગી ઔર ખુશાહાલીમેં, મુસીબત ઔર આરામમેં, તંદુરસ્તી ઔર બીમારીમેં હર હાલમેં ખુદાસે દુઆ માંગતે રહેં.
- (૧૦) દુઆકી કુલૂલિયતકા પૂરા પૂરા યકીન અપને દિલમેં રખ્યે. અગર દુઆ કે અસરાત જલ્દી જાહિર ન હોં તો માયૂસ હો કર દુઆકો હરગિઝ ન છોડો.
- (૧૧) દુઆ માંગતે વકત જાહિરી આદાબ યા'ની તહારત ઔર પાકીકા જરૂર ઘ્યાલ રખ્યે ઔર અપને દિલકો ભી બુરે બયાલાતસે પાક રખ્યે.
- (૧૨) પેહલે અપને લિયે દુઆ માંગો ફિર દૂસરોકે લિયે દુઆ માંગો.

૧. ૨૭બના આતિના  
ફિદ્દુનિયા હસનાતવ્ય વ ફિલ  
આખિરતિ હસનાતવ્ય વક્િના  
અઝાબનાર. (સૂર: બકરહ - ૨૦૧)

١. رَبَّنَا أَتَنَا فِي الدُّنْيَا حَسَنَةً  
وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا  
عَذَابَ النَّارِ ④ (البقرة: ٢٠١)

੧. ਅਥ ਹਮਾਰੇ ਰਖ ਹਮੇਂ ਫੁਨਿਆਮੇਂ ਵੀ ਭਲਾਈ ਹੈ ਔਰ ਆਖਿਰਤਮੇਂ ਵੀ ਭਲਾਈ ਹੈ ਔਰ ਆਗਕੇ ਅਜਾਬਸੇ ਹਮੇਂ ਬਚਾ। (ਖੁਰਾ: ਬਕਰਾਹ - ੨੦੧)

૨. રબ્બના લાતુઅભિજના  
 ઈન્ના સીના અવ અખ્તાના,  
 રબ્બના વ્યલા તદ્ધમિલ અલૈના  
 ઈસરન કમા હમલતાહુ અલલ  
 લગીના મિન કલિના, રબ્બના  
 વલા તુહમિલના માલા તા ક ત  
 લના બિહ, વ આ'કુઅન્ન વગુફિર  
 લના વર હમના અન્ન મૌલાના  
 ફંસૂરના અલલ કટિમલ  
 કાફિરીન. (સુરઃ બકરહ - ૨૮૬)

ર. અય હમારે રબ હમસે ભૂલ-ચૂકમેં જો કુસૂર હો જાએં ઉન પર ગિરણીત  
ન કર. માલિક ! હમ પર વહ બોજ ન ડાલ જો તૂને હમસે પેહલે લોગોં પર  
ડાલે થે. પરવરદિગાર ! જિસ બાર-બોજ-કો હમમેં ઉઠાનેકી તાકત નહીં  
હૈ, વહ હમ પર ન રખ. હમારે સાથ નરમી કર, હમસે દરગુજર ફરમા,  
હમ પર રહમ કર. તૂ હમારા મૌલા હૈ, કાંકિરોકે મુકાબલેમેં હમારી મદદ  
કર. (સુર: બકરહ - ૨૮૬)

੩. ਰਫ਼ਾਨਾ ਲਾ ਤੁਜਿਗ  
 ਕੁਲੁਬਨਾ ਬਾਅਦ ਈਸ਼ ਹਦਧਤਨਾ  
 ਵ ਹਥ ਲਨਾ ਮਿਲਖਣੁਨ ਕ ਰਹਮਣ.  
 ਇੱਨ ਕ ਅਨਤਲ ਵਡਹਾਬ. (ਚੂਰ:  
 ਆਦੇ ਈਮਰਾਨ - ੮)

٢. رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِيْنَا  
أَوْ أَخْطَلْنَا، رَبَّنَا وَلَا تَحْمِلْ  
عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ  
عَلَى الَّذِينَ مِنْ قَبْلِنَا، رَبَّنَا  
وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا  
بِهِ، وَاعْفُ عَنَّا، وَاغْفِرْ  
لَنَا، وَارْحَمْنَا، أَنْتَ  
مَوْلَانَا فَانْصُرْنَا عَلَى الْقَوْمِ  
الْكُفَّارِ (١٧٦) (البقرة: ١٧٦)

۳۰. رَبَّنَا لَا تُرِعْ قُلُوبَنَا بَعْدَ اذْهَبْنَا وَهَبْ لَنَا مِنْ لَدُنْكَ رَحْمَةً، إِنَّكَ أَنْتَ الْوَهَابُ ﴿٥﴾ (آل عمران: ۵)

٣. ای خداوند! جب تُو ہم میں سیخے راستے پر لگا۔ یوں کہے تو  
کہ کہیں خداوند! دیلوں کو کچھ پن (تھہپن) میں مुذللا ن کر دیجیو۔ ہم میں  
بھائیان کے لئے ہم اپنے ہم تھاتھ آتا کر، کہ تُو ہی یہی ہے کیوں ہے۔ (سُور: آراءہ ۱۷ - ۸)

٤. ۲۷ بجنا ای خداوند! ای خداوند! ای خداوند! ای خداوند!  
ساتھ رہ و ساتھیت اکدا مانا  
و نسونا رہنا۔ ای خداوند! کلبیں  
کا فیروز۔ (سُور: ایل بکرہ -  
۲۴۰)

٤. ای خداوند! رج! ہم پر ساتھ کا ہے ای خداوند! کہ دم جنم دے  
اوہر ہن کا فیروز گیرا ہو پر ہم میں فتح نہ سیب کر۔ (سُور: بکرہ - ۲۴۰)

٥. ۲۷ بجنا! کہ لانا گونو بجنا  
و یہ سارا ہننا ہی ای خداوند! و  
ساتھیت اکدا مانا و نسونا رہنا  
ای خداوند! کلبیں کا فیروز۔ (سُور:  
آراءہ ۱۷ - ۹۴۷)

٥. ای خداوند! ای خداوند! گلیا ہوں اور کوتا ہی یوں سے دار گو جر  
کر دم۔ خداوند! کام میں تیری ہڈو دسے جو تجاویز (بادھ ر نیک ل جانا) ہو  
گیا ہو ہے مسٹر ای خداوند! کہ دم جنم دے اور کا فیروز کے مسکا بولے میں  
خداوند! مدد کر۔ (سُور: آراءہ ۱۷ - ۹۴۷)

٦. ای خداوند! ای خداوند! ای خداوند!  
لانا و رہنا۔ ای خداوند! ای خداوند! ای خداوند!  
گا فیروز۔ و کہ تو بولنا ہی ہا کی  
ہی دھنپا ہسنان تا یہ و دیں  
آبی رتی ہننا ہونا ہلے ک۔  
(سُور: آراءہ - ۹۴۵، ۹۴۶)

٦. رَبَّنَا أَفْرُغْ عَلَيْنَا صَبَرْنَا<sup>۱</sup>  
وَتَبَّتْ أَقْدَامَنَا وَأَنْصَرْنَا  
عَلَى الْقَوْمِ الْكُفَّارِينَ<sup>۲</sup>  
(البقرة: ۲۰۰)

٥. رَبَّنَا أَغْفِرْ لَنَا ذُنُوبَنَا<sup>۱</sup>  
وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَتَبَّتْ<sup>۲</sup>  
أَقْدَامَنَا وَأَنْصَرْنَا عَلَى<sup>۳</sup>  
الْقَوْمِ الْكُفَّارِينَ<sup>۴</sup> (آل عمران: ۱۱۷)

٦. أَنْكَ وَلِيْنَا فَاغْفِرْ لَنَا<sup>۱</sup>  
وَأَرْحَمْنَا وَأَنْكَ حَمْدُ<sup>۲</sup>  
الْغَفَّارِينَ<sup>۳</sup> وَأَكْتَبْ لَنَا فِي<sup>۴</sup>  
هَذِهِ الدُّنْيَا حَسْنَةً وَفِي<sup>۵</sup>  
الْآخِرَةِ إِلَّا هُدَى إِلَيْكَ<sup>۶</sup>  
(الأعراف: ۲۰۰)

۶. ہمارے سرپرست تو آپ ہی ہیں، بس ہم میں مुआف کر دیجیے اور ہم پر رہم فرمائیے، آپ سب سے بढ کر مُعااف فرمانے والے ہیں، اور ہمارے لیے اس دنیا کی بخلاف بھی لیخ دیجیے اور آبیتارکی بھی، ہمنے آپ کی ترک رکھوایا کر دیتا۔ (سُور: آ'راف - ۹۴۵، ۹۴۶)

۷. ۲۷۶۱۱۱ آاتینا  
میلولہنکا رہمتوں پر و ہمی  
لنا میں امریکا ۲ ش ۸۱.  
(سُور: کہف - ۹۰)

۷. ای پروردگار! ہمکو اپنی رہمتوں سے نوازا جائے اور ہمارا مُعاہدہ دوسرے کر دے۔ (سُور: کہف - ۹۰)

۸. اعلالاہی تاکہ لہ  
۲۷۶۱۱۱ لہ تاجاللہ  
لی کہیں جا لی بھیں و نجیجنا  
بی رہمتوں مک میں لہ کہیں  
کا فریض۔ (سُور: یونس - ۸۴، ۸۶)

۸. ہمنے اعلالاہ پر بھروسہ کیا، ای ہمارے رب! ہم میں جا لی بھیں کے لیے فیضا نہ بننا۔ اور اپنی رہمتوں سے ہمکو کاہریوں سے نجات دے۔ (سُور: یونس - ۸۴، ۸۶)

۹. ۲۷۶۱۱۱ کر لنا و لی  
۱۷۶۱۱ نیں لیں ن س بکن بیل  
۱۷۶۱۱ بیان و لہ تاجاللہ کی کلوبیں  
گیل لیل لیلیں آم انو رجیں  
۱۷۶۱۱ رجیں رجیں۔ (سُور: ہش - ۹۰)

۹. ای پروردگار! ہمارے اور ہمارے علی بھروسے کے جو ہمسے

۷. رَبَّنَا أَتَّقَى مِنْ لَدُنْكَ رَحْمَةً

وَهِيَ لَنَا مِنْ أَمْرِكَ رَشْدًا  
(الکھف: ۹۰)

۸. عَلَى اللَّهِ تَوَكَّلْنَا رَبَّنَا لَا  
تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ  
وَنَجْعَلْنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ  
الْكُفَّارِ (یونس: ۸۵-۸۶)

۹. رَبَّنَا أَغْفِرْ لَنَا وَلَا حَوْانِنَا  
الْدِيَنَ سَبَقُونَا يَا لَيْتَنَا  
وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلَّا  
لِلَّذِينَ أَمْنَوْ رَبَّنَا إِنَّكَ  
رَءُوفٌ رَّحِيمٌ (السیر: ۹۰)

ਪੇਹਲੇ ਈਮਾਨ ਲਾਏ ਹੋਏ, ਗੁਨਾਹ ਮੁਆਫ ਕਰਮਾ ਔਰ ਮੋ'ਮਿਨੋਂਕੀ ਤਰਫ਼ਸੇ ਹਮਾਰੇ ਫਿਲਮੇ ਕੀਨਾ ਵ ਹਸਦ ਨ ਪੈਦਾ ਹੋਨੇ ਦੇ. ਅਥ ਹਮਾਰੇ ਪਰਵਰਾਇਗਾਰ ਤੂ ਬਡਾ ਸ਼ਫ਼ਕਤ ਕਰਨੇਵਾਲਾ ਮਹੇਰਬਾਨ ਹੈ. (ਸ੍ਰੂ: ਹਥ - ੧੦)

੧੦. ਲਾ ਈਲਾਹਾ ਈਲਲਾ ਅਨਾ  
ਸੁਅਤਾਨਕ ਈਨੀ ਕੁਨ੍ਤ  
ਮਿਨਗ੍ਰਾਵਿਮੀਨ. (ਸ੍ਰੂ: ਅਂਬਿਆ -  
੮੭)

੧੦. ਨਹੀਂ ਹੈ ਕੋਈ ਖੁਦਾ ਮਹਾਰ ਤੂ, ਪਾਕ ਹੈ ਤੇਰੀ ਜਾਤ, ਬੇਸ਼ਕ ਮੈਂਨੇ ਕੁਸ਼ੂਰ  
ਕ੍ਰਿਆ. (ਸ੍ਰੂ: ਅਂਬਿਆ - ੮੭)

੧੧. ਅਲਲਾਹੁ ਮਾ ਈਨੀ  
ਅਸਾਲੁ ਕ ਕਿਦੂ ਹੁਨ੍ਯਾ ਵਲ  
ਆਖਿਰਾਹ. (ਹਦੀਸ)

੧੧. ਅਥ ਅਲਲਾਹ ਮੈਂ ਤੁਸੇ ਤਲਬ ਕਰਤਾ ਹੁੰਦੁ ਬਿਖ਼ਿਆ ਔਰ ਸਲਾਮਤੀ  
ਦੁਨਿਆ ਔਰ ਆਖਿਰਤਮੌ. (ਹਦੀਸ)

੧੨. ਅਲਲਾਹੁ ਮਮ ਈਨੀ  
ਅਸਾਲੁਕ ਈਲਮਨ ਨਾਫਿਅਨ ਵ  
ਰਿਝੁਕਨ ਤਾਧੁਅਨ ਵ ਅਮਲਨ  
ਮੁਤਕਥਲਾ. (ਹਦੀਸ)

੧੨. ਅਥ ਅਲਲਾਹ ! ਮੈਂ ਤੁਸੇ ਤਲਬ ਕਰਤਾ ਹੁੰਦਾ ਹੈ ਐਸਾ ਈਲਾਜ ਜੋ ਮੁਝੀਂ ਹੋ  
ਔਰ ਪਾਕ ਰੋਜੀ ਔਰ ਐਸਾ ਅਮਲ ਜੋ ਮਕਬੂਲ ਹੋ. (ਹਦੀਸ)

੧੩. ਅਲਲਾਹੁ ਮਮ ਈਨੀ  
ਅਉਗੁਬਿਕ ਮਿਨਲ ਹਮ੍ਰਿ ਵਲ  
ਹਜ਼ਨਿ ਵਲ ਅਝਜ਼ਿ ਵਲ ਕ ਸ ਲਿ  
ਵਲ ਜੁਭਨਿ ਵਲ ਬੂਖ਼ਿ ਵ ਜ ਲ  
ਈਦੈਨ ਵ ਗ ਲ ਬਤਿਰਿਆਲ.

੧. لَّا إِلَهَ إِلَّا أَنْتَ سُبْحَنَكَ إِنِّي

كُنْتُ مِنَ الظَّالِمِينَ ﴿٧﴾

(الأنبياء: ٢٧)

੧੧. اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ

فِي الدُّنْيَا وَالآخِرَةِ (حدیث)

੧੨. اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عَلَيْهَا

تَافِعًا وَرِزْقًا ظَيْبًا وَعَمَلاً

مُتَقَبِّلًاً. (حدیث)

੧੩. اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْهَمَّ

وَالْحَرَّنِ وَالْعَجَزِ وَالْكَسْلِ

وَالْجُنُونِ وَالْبُخْلِ وَضَلَّعِ

الدَّيْنِ وَغَلَبَةِ الرِّجَالِ.

---

١٣. અય અલ્લાહ મૈં તેરી પનાહ માંગતા હું આજિઝી, સુસ્તી ઔર  
બુઝદિલીસે, કંજૂસી, કુશ ઔર ગુનાહસે, જઘડે, શોહરતકી ઘ્વાહિશ ઔર  
દિખાવેસે. (સહીહ બુખારી નં. ૬૭૬૮)

١٤. અલ્લાહુમ્મ ઈન્ની ١٢  
જઈનુન ફક્તિવની વ ઈન્ની  
જલીલુન ફાર્થજુની વ ઈન્ની  
ફકીરુન ફર્જુકની.

اللَّهُمَّ إِنِّي ضَعِيفٌ فَقَوِّنِي  
وَلَيْسَ ذَلِيلٌ فَاعِزِّنِي وَلَيْسَ  
فَقِيرٌ فَارْزُقِنِي

١٤. અય અલ્લાહ ! મૈં કમાઓર હું મુજે માય્બૂત કર, મૈં જલીલ હું મુજે  
ઈઝૂત દે ઔર મૈં મોહતાજ હું મુજે સામાનેજીસ્ત આતા કર.

١٥. અલ્લાહુમ્મ ઈન્ની  
અઉજુબિ ક મિનલહમિ વલ હ  
જ નિ વ જલઈદ્દૈનિ વ ગ લ  
બતિર્જાલિ વલ હ ર મિ વ  
સૂઈલકિબરિ વ અઉજુબિ ક મિન  
અન ઉરદ્દા ઈલા અર્જલિલ  
ઉમ્ર.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ  
الْهَمَّ وَالْحَزَنِ وَضَلَالِ الدِّينِ  
وَغَلَبَةِ الرِّجَالِ وَالْهَرَمِ  
وَسُوءِ الْكِبَرِ وَأَعُوذُ بِكَ مِنْ  
أَنْ أَرَدَّ إِلَى أَرْكَلِ الْعُمُرِ

١٥. અય અલ્લાહ ! મૈં તેરી પનાહ માંગતા હું ફિંક ઔર ગમસે,  
કંકિ બોજ ઔર લોગોકે દબાવસે, બહોત જ્યાદા બુઢાપે ઔર બુરે બુઢાપેસે  
ઔર મૈં ઈસસે પનાહ માંગતા હું કે મૈં નિકમ્મી ઉમર તક લોટા દિયા જાઉ.